

श्री

जैनधर्म प्रकाश.

शार्दूलविक्रिडितम्.

ये जीवेषु दयाद्वयः स्मृशति यान् स्वव्योपि न श्रीमदः
श्रांता ये न परोपकारकरणे हृष्यन्ति ये याचिताः ।
स्वस्थाः सत्स्वपि योग्यनोदयमहाव्याधिप्रकारेषु ये
ते लोकोत्तरचारुचित्रचरिताः श्रेष्ठाः कर्ति स्युनंगाः ॥

ज्ञेने भुवन्या वरी मनविषे, लक्ष्मीतये, भर्व नहो,
उपकारे नहो थाक, धायकभये आदाद भाने सही;
सर्वति चिततथी, बुवारी भट्टा देहे देखये नही,
अंगवा सुन्दर श्रेष्ठ सुक्ता गुणी, शेषादे जपलते भडी. १

प्रस्तुतक २५ भु. माल. संवत् १९७०, शाके १८३५. अंक ११ भे.

अगट कर्ता.

श्री जैनधर्म प्रसारक सभा, भावनगर.

अनुक्रमणिका.

१	पिंड पिक्कर...	३२३
२	प्रक्षेप्य नियारो।	३२४
३	सुकृतमुक्तावणी...	३२५
४	यद्यनानना रास्त उपर्या नीकिगतो सर्व...	३३०
५	अेक हुदयनात्त संध्या...	३४०
६	जैन साधित्य-समेलन मठे हिक्काल.	३४३

श्री “सरकारी” छापणातु—भावनगर.

भ्रम्य दा. १)

फोस्टर ३०, ०-४-० लेट शोबे.

(हुआमां छपाना अथो अने भुक्ते ।)

- १ श्री खड़मचन्द्रिकन् (मागधी गाथाण्ड) रामचन्द्रिन्.
- २ श्री पार्वतीनाय चरित्र. संकृत गवणांध.
- ३ श्री आनन्दगणेशना ४० पहो. विवेचन लिहित.
- ४ श्री अद्यात्मसार अंथ टीका साथे.
- ५ श्री अद्यात्मसार अंथ भूग ने भूग टीकाना लायांतर साथे.
- ६ प्रकरणोना रत्ननादिनो संचड (धीलु आवृत्ति)
- ७ गानपत्यभी. (धीलु आवृत्ति)
- ८ वैत्यवंदन चोवीशी. शुभराती. (चोथी आवृत्ति)
- ९ ए प्रतिक्रियु सूत. शुभराती, शीलाभाष्य (पांचभी आवृत्ति)
- १० उपदेशप्रासाद भूग (स्थांब १ थी १)

(प्रेस कोपी तैयार के ते हुवे पछी छपाये)


- ११ सूक्षमार्थ विचारभारदाहर सार्वशतक. टीका साथे.
(गाम कोट्यवाणा शा. मुग्धवं लकालु निरेते तरस्थी)
- १२ श्री उपदेशभाषा भूग ने चोग शास्त्र भूग.
(तैयार थता थवाना निर्षयवाणा अथो)
- १३ श्री हेमचंद्राचर्य चरित्र.
- १४ श्री उपर्गति भवभूपत्या कथानु आपु लायांतर.
- १५ श्री परिशिष्ठ पवे लायांतर.
- १६ श्री उपदेश प्रासाद भूग संगूरु (स्थांब ७ थी २४)
- १७ आरांबभित्रि, जनशुद्धि, हिनशुद्धि (जैनज्येष्ठित्यनां उथोथो) भूग लायांतर साथे
(लीभरी भाषेक तरुष्ठी),

उपर अख्यादेवा अथो पैदी २-४-५-६-७-१०-११-१२-१३ नं अवृत्तवाणा
अथो अन्य गुडुस्थाही सदायथी बहार पड़नाना के. ३-८-६-१३-१४-१५
लायांतरना अथो सभा तरही बहार पाइनाना के, तेमां सदायथी अपेक्षा नदी. आडो
लायांतर पेक्षाने गाए अन्य सहायनी अपेक्षा के. निनशी द्रव्यने अवि-
लायी कठवा. ईच्छनार-गोला द्रव्यनो सहुपथीय करना ईच्छनार गुडुस्थिविचार
ज्ञानादेवा. तेमनी उदार छुच्छा आतुसार व्यवस्था करी चाप्यासामां आवदो. तांत्री.

लक्ष्मीसुवावना हरा द्रष्टांत.

आ नानी सरणी पैहेट पुक ने दृढ़ मतुष्ठे-दृढ़ कैते पैतानी पासे
वाणी पैताना अभूत्य गतुप्य लवनी किंसत शु ले ते सदायथी लेहिये, ते अभा-
वाणीं प्रभाव हो ? उमित भान वेह व्यानो के. सचिव कथावाणी लेतायी
नाना आपाक्तने पछु नाम्यना शानह उत्तरक कै तेम के. जिनदूर्ग विजेतानो रहोवाहा
लायक के. सामटी भागलतानो वालु गैसाथी आप्यवासो ज्ञानी. पैदीज भुज
हो. नहीं बांग्यानानो लाल (विविधकरी लालहानो)

जैन धर्म प्रकाश.



जो जो जब्याः प्रदीप्तज्ञवनोदरकद्वयोऽयं संसारदिस्तारो निवासः शारी-
रादिदुःखानां । न युक्त इह विदुपः प्रमादः । अतिदुर्बलं यं मातृपावस्था ।
प्रधानं परद्वोक्तसाधनं । परिणामकटवो विषयाः । विषयोगान्तानि सत्सङ्गतानि ।
पातञ्जयातुरमविज्ञातपातमायुः । तदेवं व्यवस्थिते विषयापनेऽस्य संसारप्रदीप-
नक्षय यन्तः कर्तव्यः । तस्य च हेतुः सिद्धान्तवासनासारो धर्मविषयः । अतः
स्वीकर्तव्यः सिद्धान्तः । सम्यक् सेवितव्यास्तदज्ञानाः । ज्ञावनीयं मुण्डमा-
तिकोपमानं । त्वक्तव्या खब्बमधेक्ता । ज्ञवितव्यमाङ्गाप्रधानेन । उपादेयं प्रणि-
धानं । पोषणीयं सत्साधुसेवया । रक्षणीयं प्रवचनमादिन्यं । एतच्च विधि-
प्रवृत्तः संपादयन्ति । अतः सर्वत्र विधिना प्रवर्तितव्यं । सृत्रानुसारेण प्रत्य-
निज्ञातव्यमात्मस्वरूपं । प्रवृत्तावेक्षितव्यानि निमित्तानि । यतितव्यसंपद्य-
योगेषु । ऋक्षयितव्या विस्तोतसिका । प्रतिविशेयमनागतमस्याः । ज्ञवितव्य-
प्रवर्तिमानानां सोपक्षमकर्मविद्वयः । विच्छिन्नते निरुपक्षमकर्मानुवन्धः । तस्मा-
दत्रैव यतद्वं यूयमिति ॥

। उपमितिज्ञवप्रपञ्चा कथा ।

पुस्तक २६ भुं.

भाष्ठ. सं. १५७०. शाढे १८७५.

भं ११ भी.

पिंड पिंजर.

आंण विना आंधारू रै, सदाय भारे—ये राग.

पंणी विना डोष भालै रै, पांजरीयाभां, पंणी विना डोष भालै ये टोँ.
इंसा पांजरीयु ताड़, नथी कायम रहेनाड़;
भालु न फले आज कालै रै. पांजरीयाभां १
ज्यु गला पंणी उटी, घुड रहा आणा सुटी;
ज्यु गला आलै रैठा जालै रै. पांजरीयाभां २
वेसरी उडी गालै, ठाठ गूळी रुलै;
देलु रहेलै तो हिसाख लालै रै. पांजरीयाभां ३

धर्मसु धर्मती रही थानी, अंतर अगनी युआणी;
 डोँड भूमि ल लवार चाले रे. पांजरीयामां० ४
 परखी उडेवीथी वहेली, नहे लगी सगा सगांधी;
 आदी पांजरीयुं जोदी लागे रे. पांजरीयामां० ५
 पिंजर सांकुणयां ह गावे, लक्ष मत प्रभुने लावे;
 जन्म भरखुना देरा लागे रे. पांजरीयामां० ६

प्रकीर्ण विचारो.

(उद्घरेला.)

१ चिंताथी थती हानि.

“ चिंतासे अतुराई धटे, धटे ३५ युख शान;
 चिंता अदी अभागली, चिंता चिंता समान.”

२ मुखवस्त्रिका (मुहूपति) शामाटे राखवी जेठमे ?

“ संपातिमादिसच्चानां, रक्षायै मुखवस्त्रिका ”-

उठता त्रसादिक लगेनी रक्षा माटे जानी मुझमेंचे मुहूपति राखवी कही छे.

३ पात्र-भाजन क्षेत्रन अवसरे शामाटे वापरवां जेठमे ?

“ भक्तपानस्थजन्तुनां, परीक्षायै च पात्रकम् ”

आत पाणी (खान-पान) मां आवी गधेलां जंतुओनी तपासे ४२वा
 निभिते यावत् द्वपरना णचान माटे पहेला-विशाणु भाजनमां भेजन ४२वा
 (अने तेने पछु सारा प्रधाशवाणा दथगमां उपयोग ४२वा) इरभावेलुं छे.

४ रजेहरखु डे चर्वणो राखवानुं शुं प्रयोजन लेलुं जेठमे ?

“ जनुप्रमार्जनार्थं हि, रजोहरणमिष्यते ”

जहां आवतां, ऐसतां उठां, डे शयनादिक ४२तां क्षुद्र जंतुओना णचान
 आटे प्रभार्जन ४२वा निभिते रजेहरखु डे चर्वणो राखवा इरभावेलुं छे.

५ संक्षेपथी लालाचार डोने क्यों हे ?

“ लोकापदादभीरुत्वं, दीनाभ्युदरणादयः

कुतश्चतु शुदाक्षिण्यं, सदाचारः प्रकीर्तिः ”-

लोकपदादधी झीवापछुं, हीन-हुःणी ज्ञेने संगीत सहायादिकवडे उदुर-
 गापछुं, कृष्णलाला (४र्यो शुदुहु शुभुपछु) अने लक्षी दाक्षिण्यता दाणी परहित
 नाही. लालाचारी कृष्णलाला क्षेपथी सदाचार डोने हे.

પ્રકાર્થ વિચારો.

૩૪૫

૬. ઉપવાસ કોને છદીએ ? અને તે કરવાનો ખરો હેતુ શો હેઠો જેઠાં ?

“ અપવૃત્તસ્ય દોપેભ્યઃ, સમ્યગ્વાસો ગુણૈः સહ;

ઉપવાસઃ સ વિજ્ઞેયઃ, ન શરીરવિશોષણમ्.”-

રાગ દ્રોધાદિક દોષો થકી નિવૃત્ત થવા પૂર્વક સદ્ગુણોવડે સારી રીતે વાસિત થબું તે ખરી રીતે ઉપવાસ સમજયો. શરીરને શોષણી નાખબું તેનેજ માત્ર ઉપવાસ સમજયો નહિ. પણ તેમાં દોષનું શોષણું અવસ્થય થબું જેઠાં.

યતઃ—“કપાળાવિપયાઽહાર-ત્યાગો યત્ત્ર વિધીયતે;

ઉપવાસઃ સ વિજ્ઞેયઃ શેર્ષ લંઘનકં વિદુઃ”-

જેમાં કોધાદિક ક્ષાય, પાંચ ઈદ્રિયોના વિવિધ વિષયો અને અથનાદિક આદ્યારનો ત્યાગ કરવામાં આવે છે તે ઉપવાસ જાણ્યો. યાદીની તો લાંઘણું જાણ્યો. એમ જાની પુરુષો છેણ છે.

૭ તુન્ય અને પાપનો વ્યુતપત્યર્થ કણો ?

“ પુનાતિ તત્પુન્યમ् ॥ પાંશ્યયતિ મલીનયતિ તત્પાપમ् ”-

(આત્માને) પાવન કરે તે તુન્ય અને મલીન કરે તે પાપ જાણું.

૮ વગર વિચારે અતિ રભસપણે કાર્ય કરવાથી કેવું પરિણામ આવે છે તે સંશેપથી કણો ?

“ સગુણમપગુણં વા કુર્વતા કાર્યજાતં,

પરિણતિરખવધાર્યા યત્નતઃ પણ્ડિતેન;

અતિરભસકૃતાનાં કર્મણામાવિપત્તઃ:

મત્વતિ હૃદયદાદિ શલ્યતુલ્યો વિપાકઃ”-

સારું કે નરતું ગમે તે કાર્ય કરતાં હાદ્ય ભાષુસે તેના પરિણામનો સારી રીતે ઝુદ્ધિબળથી વિચાર કરી જેઠાં. કેમકે અતિ રભસપણે જે કાર્ય કરવામાં આવે છે તેથી એવી વિપત્તિ આવી પડે છે કે જેથી હૃદયને ભારે પરિતાપકારી વિપાક લોગવદો પડે છે. પરિણામભર્યીપણે વિચારને કાર્ય કરનાર તેવા કણુક વિપાકથી બધી જાય છે.

૯ ઈન્દ્રા-મનોરથ ઇણીસૂત થવાને જાણ્યા ભાર્ગ હર્થાને ?

“ First deserve and then desire.”---

ભૂતા દેવસત્તા-દુર્ગાદુર્ગ મેળવે કરે જારી પૂર્ણા-મનોરથ હોય.

૩૨૬

જન્મધર્મ પ્રકાશ.

૧૦ સુશીલતાં અત્યે પડે તે હવ્યાંથી જવાય એવો માર્ગ ગતાયો ?

" Patience and Perseverance overcome mountains." —

ધીરજ અને અંતથી મંકાણ પહોંચોનો પણ પાર પમાય છે.

૧૧ 'No labour no fruit' - મહેનત (ઉદ્ઘામ) ઠથી વિના ક્ષળ મળતું નથી.

૧૨ 'As you sow so you reap' - જેવું વાયનું એવું લખયું.

૧૩ સાત્સ્યમું=પ્રકૃતિને અનુકૂળ થાય તેવું.

૧૪ મનની કિઝ લિજ અવસ્થાએ.

૧ વિક્ષિપ (અતિ ચંચળ-ચંચળ), ૨ યાતાયાત (થોડું ચંચળ), ૩ રિક્ષિપ
(સિધર) અને ૪ સુદ્ધીન (લય પામી ગયેલું-સુસ્થિર-સમાધિસ્થ થયેલું મન).

૧૫ "વિદ્યાન-ચતુર માણુસે ધર્મની પરીક્ષા ડેવી રીતે કરવી જેઈએ ?

" યથા ચતુર્ભિં: કનકં પરીક્ષયતે, નિર્વર્પણચ્છેદનતાપતાડનૈ: ।

તથેવ ધર્મો વિદુપા પરીક્ષયતે, શ્રુતેન શીલન તપોદ્વયાગુણૈ:"—

જેમ ક્ષે, છેદ, તાપ અને તાડન એ ચાર પ્રકારે કનક (સેનાનિ) ની પરીક્ષા
કરવામાં આવે છે તેમ શ્રુત (જ્ઞાન), શીલ (સદ્ગ્યાર), તપ અને હ્યા શુદ્ધયાડે
વિદ્યાન, માણુસ ધર્મ-દસ્તની પરીક્ષા કરે છે. ધતિશમ્.

સુત્કમુર્કાવળી.

સંસ્ક્યગ્ર જ્ઞાન અભ્યાસયોગેજ સાચી સમજ આવે છે.

તન ધન ઠકુરાણ, સર્વ એ લુધને છે,

પણ છીકજ હુણીલું, જ્ઞાન સંસારમાં છે;

ભવ જગ્યા નિધિ તારે, સર્વ ને દુઃખ વારે,

નિજ પર લિત હેતે, જ્ઞાન તે કાં ન ધારે.

જવ જન્મિ કંગાથા, યોગ્યથી ભય નિવાર્યો,

કંગ પદ્ધથી ચિનાતી-પુત્ર સંસાર વાયો;

શ્રુત અણુન સુજ્ઞાની, માસ તુસાહિ થાયે,

શુનથી અલય હૃદ્યે, રેણુણી ચાર નાયે.

૧.

૨.

" જ્ઞાન એ અભૂત દ્વારાયથું, અભૂત અને અભૂત છે એમ જ્ઞાન શાસ્ત્રકારો કહે છે. "

જુને પૂર્વ પુન્ય લેગે સુંદર-મનોહર-મજાયુત-નીરોગી દેહ મળી શકે
છે, જેને હેળી અન્ય જનો ચક્કિત થઈ જય છે તેમના મોહિત જની જય
છે; વળી પુન્ય લેગે વિશાળ લક્ષ્મીનો અન્નેગ થઈ શકે છે, જેને હેળી લોડો
લેને હુમેર લંઘણી મયુદ્ધનાં હુમનામ આપે છે; તેમન પુન્ય લેગે જુરને મન-

સમ્યગુણ જીવન અધ્યાત્મિકોગ્રામ સાચી સમજ આવે છે.

૩૨૭

માનતી મોટી ઠુરાઈ, મોટા માનતંતા હોદ્દો, એતાબ વિગેર એનાયત થાય છે; જે હેખી લોડો તેની સુકૃત કંઠી પ્રશાંતા ફરે છે. આ બધું પૂર્વ પુન્ય જોગે જીવને માસ થવું સુવલસ છે. દુર્લભ કેવળ જીવને સાચું-સમ્યગુણ જ્ઞાન પ્રાપ્ત થવું એજ છે. જીવ જીવની જીવણ જીંગનાર સાચું-સમ્યગુણ જ્ઞાનજ છે. વિનય-અહુ-માન સહિત સદગુરની સેવા-અદ્દિત કરતાં જાય જીવને એવું સાચું તત્ત્વજ્ઞાન માસ થઈ શકે છે. તેનાં ફ્રાણ અંદોચિક કદમ્બાં છે અને એથીજ એવા અમૃત્ય જ્ઞાન માટે યત્ન કરવો જરૂરનો છે. સદગુરની સાચા હીલથી વિનય-અહુમાન સહિત સેવા જાહીત કરતાં તેમની કૃપાથી સહેજે સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે; એટલે જીવના ઉપર આવી રહેલાં કર્મનાં આવરણું એહાં થતાં જાય છે અને એથી અંતરમાં જીવ ઉજાશ-પ્રકાશ થતો જાય છે, જેથી જીવને સત્યાસાસ હિતાહિત, કૃત્યા-કૃત્ય, લાભાલાભ, અભ્યાભક્ષય, પ્રેરાપ્રેર અને શુષ્ણ હોણતું ખરું જાન થઈ શકે છે. આતું એવટ પરિણામ એ આવે છે કે જીવને સત્ય-હિત માર્ગ તરફ ડ્રચિ-પ્રીતિ વધતી જાય છે અને અસત્ય-અહિત માર્ગ તરફની ડ્રચિ ઘટતી જાય છે. આ રીતે અનુકૂળે વધતા જતા વિયેઠ-અભ્યાસ વડે જીવને ચિન્તામણી રતન સરળા અમૃત્ય સમદિત રતનની પ્રાપ્તિ થઈ શકે છે. જેમ એઠા ઉપર કરેલાં સથળાં મૌંણ સાર્થક થાય છે તેમ સમદિત કરવામાં આવતી સધળી કરણી લેણે થાય છે, પ્રમાદ હોય એછે થતો જાય છે અને ક્ષમા, મુહુરતા (નન્ત્રતા), સરદતા અને સંતોષાહિક સદગુરુઓ પ્રગટ-પેદા કરવા આત્મા જગત થતો જાય છે એટલે વીરોદ્ધાસ વધતો જાય છે અને શુદ્ધ આચાર-વિચારનો અભ્યાસ કરવા આત્મા સમર્પથ થઈ શકે છે. એ રીતે વિનયપૂર્વક કરેલ સમ્યગુણ જ્ઞાનનું આતું રૂડું પરિણામ આવે છે. સમ્યગુણ જ્ઞાન કરો કે આત્મા જ્ઞાન સાથે આત્માનું ખરું હિત-કર્ત્યાણું સાચી શકે એવી સાચી કરણી લેણે છે-એક રસ થાય છે ત્યારે તે જલહી જીવને જન્મ ભરણનાં દુઃખમાંથી સુકૃત કરાવી શકે છે. જેમ જ્ઞાનમાં જગ્નો રસ સાથેજ મળી રહે છે તેમ સમ્યગુણ જ્ઞાનમાં સાચી કરણી પણ સાથેજ મળી રહે છે, તે એક બીજાથી વિઝ્ઞાનાં રહેતાંજ નથી. પછી તે કરણી પાછ્ય રૂપે હોય કે અભ્યાંતર રૂપે હોય. શુદ્ધ ઉપરોગ સહિત કરતી સાચી કરણી સથળાં દુઃખનો અંત કરે છે અને વિશેષમાં તેથી અન્ય અનેક જન્ય જીવેનું પણ હિત સધાય છે. મતલબ કે આવા સરદ સ્વભાવી જીવનું પોતાનું કર્ત્યાણું તો નિઃસંશોધ થાય છે પણ એતું અનુમોદન કરનારનું તેમજ થથાચકિત તરફત વર્તની કરતાનરનું પણ જરૂરે ક્રીય થઈ શકે છે. આ ગ્રામાંથી અનેટ રીતે સ્વચ્છ-રસે ઉપકાર કરતાં સમ્યગુણ જ્ઞાન છે એસ જે સમજ્ઞામાં અને તો પછી એટં આપાંત કરુને ધેર મેરા કરતાં છે સુખાના અર્થી જાદુ બદેનો રસે હૈનું હિત કરતાં કરી

पूर्वे जब नामना कठिन-मुनिये एक गायाना गोद भावती मरणने
लघु निवार्ये (ऐ वात शास्त्र प्रसिद्ध हे) अने चिकानिपुरे उपशम, विवेक
अने संवर इप भदना परिव्य भावती लवभ्रमणु निवार्यु न्यारे तेषु भद्रात्मा
मुनि पासेथी ऐ भदनु वृच्छु कर्मु लारे ते पदनो रहस्यार्थ नवावानी ईच्छा
थंड तत्संबंधी भनमां उडा वालोव इत्ता तेन तेने यथार्थ लाव सूक्ष्ये;
ऐरुदे तेषु डोधाडिक इपायने शमावी दीधा अने हिताहित, हृत्याकृत्य, वावत
स्वान्यात्मान्यने निर्णय फ्री पोताना एक हाथमां रहेलु अद्ग अने णीज
हाथमां रहेलु सुखीमा कन्यानु भस्तक तथु दीधु; पछी पोते एक भद्रात्मा मु-
निनी घेरे ठाचेत्सर्ग ध्यानमां निश्चापेषु उला रवा, त्यां वज्र ज्वेवा तीक्ष्ण
मुख्यी उंभ मास्ती अनेक श्रीहीये तेने वणी, केशी तेनी छाया चालणी ज्वेवी
थंड गर्द तोपणु पोते निश्चाप ध्यानथी उग्या नहि अने अदी हिवसमां आ
क्षणउसंगुर होहनो त्याग फ्री पोते सद्गतिना लागी थया, ऐ सम्यग् ज्ञानने
प्रभाव समज्यो, सम्यग् ज्ञानना प्रभावथी छवनु डेट्वु णु श्रेय थाय हे?
थुत ज्ञानना 'मा इप मा तुप' ऐवा एकादी पहना प्रभावथी भाष-
तुपाडिक इहक लुयो सुज्ञानी थध परम इत्याणु साधी शक्या हे अने एज
शुन ज्ञानना के थेऊक ऐव रोहिउया चोरना फानमां परी गया हुता तेना
प्रभावथी ते अभयकुभार ज्वेवा भुद्विवंतना हाथमां आवी शक्यो नहोतो.
अर्थात् प्रभुना मुख्यी निकेलां थेऊक वयन तेना फानमां वगर ईच्छाये पड्यां
इतां तोपणु तेयी ते णीजी ज्वा पाम्यो हुतो. तो पछी जे लव्यात्माओ लाव
सहित सर्वज्ञ लापित वयनेनो आहर फ्रे तेमनु तो झेलुन शु? तेओ तो
अवश्य स्वश्रेय आधी शकेन, ऐम समजु सत्य ज्ञान अभ्यास करवा सहु डें-
ठुम्ये श्रीवट राणवी युक्त हे. ऐ ज्ञान-गुणवडेऽ अनुकेम आत्मा अक्षय सुग
पामी शके हे. इतिशम.

मनुष्य जन्मनी दुर्लभता अने तेनी अनन्य उपयोगिता.

भवज्ञावि भमना, डोर्वेगा विशेषे,
मनुष्य जन्म लायो, हुक्केहो रेल लेखे;
महारा कर सुधर्मे, जन्म ते धर्म योगे,
परम्पर भुख लेवी, भोक्त लक्ष्मी प्रभागे. १
मनुष्य जन्म पासी, आणेस जे गमे हे,
शक्ति वृपति घे ते, शोचनाथी भर्मे हे;
हुक्कु दश कथा कर्मु, भानुपौ जन्म घे हे,
नित बदल विनेहे, गेलतां शार्व ते हे. २

भगुत्य जननी हुक्म लाता अन तना अनन्य उपयोगता।

उद्देश

आ चार गतिरूप संसार सायदमां कर्मवश अरदा परहृष्टा अथडातां पछडातां तथाप्रहान्नी अकाम निर्वर्दहिक येजे अतुरूप समयते पाभी छुव चिन्ताभिल्लि रत्नसमान अभूत्य मानव लव मेणवी शके छे. एवें अभूत्य-हुर्लभ मानव लव पाभीने सर्वज्ञ लगाने बतावेला दान, शीत, तप अने लावरूप धर्मनुं सेवन करी तेने देखे ४री देवा युक्त छे. अहिसा, संयम अने तप लक्षण् धर्म भद्रा भंगलक्षादी छद्या छे. ए धर्ममां केनुं मन सदाय वत्यां ४रे छे तेने भेणाटा देव दानये पथु नमस्कार ४रे छे. ए धर्मनुं यथाविध अभंड आराधन ४रनार मुनीश्वरो भोक्षनां अक्षय सुख मेणवी शके छे अने मुनियोग्य भद्रावतोने पाणवाने अशक्त एवा के अवृत्य लुवो तेनुं देशाथी (अंशाथी पथु) आराधन ४रे छे ते पथु स्वर्गाहिक सद्गतिनां चठीयातां सुख संपादन ४री अंते अक्षय सुख मेणवी शके छे. एम समलु साचा सुखना अर्थी लाई फेनोअम्ब्र प्रमादायरण्यथो आ अभूत्य मानव लव वृथा ज्वाहेवो नहि. स्वस्त्र स्थिति-संचोगाहिक अनुसारे सुहु डेइअम्ब्र यथाशक्ति नत नियमनुं पालन ४री आ नरसनने आर्थक ४रवो नेइअम्ब्र. बुद्धिमत्ताने पाभी आपणु आपणु हिताहित समलु हितमार्गज आहरवा उजमाण थवुं नेइअम्ब्र. पुन्य नेगे लक्ष्मी पाभीने विवेकसर तेनो ४र२ ज्वेवा स्थणमां सहुपयोग ४री देवो नेइअम्ब्र अने वाइपुक्ता (वयन वदवामां कुशणता) पाभीने प्राणीअने प्रीति उपरे एवां नरमाश भद्रेलां, भीडाशवाणां अने हितरूप थाय एवांज वयन वदवां नेइअम्ब्र. आ विगेरे हुर्लभ सामधी पूर्व पुन्यनेगे पाभी के अव्यात्माअम्ब्र. स्वहित ४री देवा सावधान रहे छे तेज पुन्यात्माअम्ब्र अतुरूप प्रसंगने पाभी पर लुवोनुं पथु हित हुडे धरी ४री शके छे; अने ए रीते स्वमानवभवने सहश ४रे छे. आ मानवभवने चिंताभिल्लि रत्नसमान एट्ला माटे गजेल छे उ एना वगर डॉर्ड छुव कहापि पथु अक्षय अनांत भोक्षसुख मेणवी शकतो नथी. आवा उदार आशयथी उत्तराध्ययन सूक्ष्ममां आ मानवलव दश हृषान्ते हुर्लभ वणायेअ ए. ते साथे चायर्सेव, उत्तम कुण, धन्त्रिय पटुता, शर्हरे सुख, धर्मश्रद्धा-दृच्छ, सद्गुरुयोग अने वर-नियमरूप विवरिता परिषिरुम ए सबै उत्तरात्तर पुन्यवेज प्राप्त थह शके छे. तेव. हुर्लभ शुल सामधी भद्रा पुन्य नेगे पाप्या पधी सुख ननेअम्ब्र स्वपर हित साधी देवा लगारे आणस ४रवुं न नेइअम्ब्र. एम छता आणस-प्रभातथी के ज्ञेनो आ शुभ सामधीनो नेइतो लाल लेता नथी, वायदामां ने वायदामांज पौतानो वण्ठी वण्ठी वीतावी हे छे ते आपडाने पाठ्याथी शहदा राजनी पेरे अहुज शोयवुं-पत्तावुं पटे छे. शशि राजने तेगाना वीज वाधुअम्ब्र वाहु भ्रमनन्या अतां तेजे विषयतृप्त्याहिता. परवशप्रभुअधी तेनुं देहेतुं मान्युं

न हुतुं, केवी ते भाइ परिष्ठमे भवीने नरकमां गयो हुतो. लां (नरकमां) भद्रा कृदर्थना सुहुन ४८वी पटे छे तेथी तेने पोताना स्वच्छं ह आचरण मारे णाहुन ऐह उपज्ञवा लाग्यो. पछु अथी वणे क्षु ? अुरी बुरीने पछु नरकनी शिक्षा लेऊगवी तो गडेअ, एमां क्षुं चासेज नहि. आ वात सहु कोहने एक सरणी रीते लागु पटे अेवी छे. तेथी पाणी पडेलांज याग बांधवा केवी अगमयेनी वापरी स्वपर हित साधनवडे शास्त्रेक्त दश हृष्टांते हुर्क्ष मानवक्षव सङ्खण करी लेवा चूक्षुं नहि, केवी पाण्याती पस्तावो ४२वो पटे नहि.

राग द्रेष अने नोहाडिक सर्व विकाराथी सर्वथा रहित वीतराग परमात्मा होय छे. तेमां परम हितकर वयन एज आगम वयन छे. ए आगम आप खुने सत्य मार्ग खाताने छे. ए मुख्य चालवाथी आपणो मानव लक्ष सङ्खण ज थाय छे.

धर्मशम्

चंद्रराजाना रास उपरथी नीकलतो सार.

अनुसंधान पृष्ठ २८६ थी.

प्रकरण १३ मुँ.

प्रेमलालन्धी तेना पिताने क्षेत्रे उे—“हे पिताज ! प्रथमतो असंलवित वातीं छे अने वणी आप सरणा वडीलनी पासे भारा केवी णाणाच्चे क्षेत्री ते लाज आवे तेवी छे, परंतु अत्यारे लक्ष्याती क्षार्यनो विनाश थाय तेम होवाथी क्षेत्री पटे छे. हे तात ! आपे भने जे वर सांघे परखावी छे ते आ वर नथी. ते तो आला नगरीना घाणी चंद्र नामे राज छे. आ फुष्ट तो तेनी पासे गृष्ण तूल्य छे. भारा पति वीसेन राजना पुत्र छे. आ वात आप चाठस ध्यानमां द्यो. एमां कांध पछु सहेह ४८वा योग्य नथी. आ हुक्कित जे जोटी पटे तो योरना न्याय प्रभाणे भारा न्याय ४८ले. हुं प्रतिज्ञाथी णंधाउ छुं.”

सुखुद्धि भन्नीचे पृष्ठयुं उे—“हे सञ्चुपुनी ! ते शी रीते जायुं उे तारा पति आभाध्यां चंद्र नदेश छे ? ते हुक्कित रपष्ट रीते तारा पिता पासे प्रकट ४८.”

प्रेमला योदी उे—“हे पिताज ! पाणी चहायु डिया थई रद्या पडी अमे सोगडाण्यालु रमवा बेळा त्यारे ते योद्या उे—‘आल रमवाना सुंदर पासा तो आलापुरीना पति चंद्रराजने त्यां छे ते जे अहों कोइ लावी यापे तो रमवामां आनंद आवे.’ भारा पतिना आवा असंबंध वयन सांकणी में विचारुं उे—‘आ क्षुं क्षेत्रे ? आभानगरी तो पूर्व दिशाचे छे ने आतो पश्चिम दिशाची

થાલીના નિસ ડગર્થી નીકળતો સર.

૩૩૬

આંદ્યા છે. પણ ડેઢાંચે ત્યાંના પાસાની વાત એમની પાસે કરી દ્વારો અથવા એમનું મોસાળ ત્યાં હશે તેથી એ પાસાને સંભારે છે. 'મારું હૃદય લેણું હોવાથી તે વચ્ચના મર્મને હું સમજું શકી નહીં. વળી મેં એમ પણ વિચાર્યું કે-' હંતે સંધેજ રહેવાનું છે એરથે એનો ખુલાસો પુછી લઈશ, ઉત્તાવા શું છે.' ત્યાર પછી તેમને જમવા ગેસાડ્યા તે વળને મોટક આંદ્ય રહ્યા એરથે મેં સુગંધી જાણ આપ્યું. તે વખતે તેઓ જોવ્યા કે-' જે ગંગા નવીનું પાણી હોય તો તે મને મધુર લાગે.' હું એ વચ્ચન સંભળાને પણ વિદ્યમય પાણી. કેમકે ગંગાની તો પૂર્વ દિશા તરફ વહે છે અને આ તો પદ્ધિત તરફથી આંદ્યા છે છતાં તેને કેમ સંભારે છે? પરંતુ ગંગાનીતાના પાણીની જગપસિદ્ધ નિર્મળાના સંભળેલી હોવાથી સંભારતા હશે એમ ધારી મેં તે વિષે કાંઈ પુછ્યું નહીં. ત્યાર પછી તેમણે કેટકાક આલાનગરીના વાણાંદ્ય કર્યો. હે તાત! તેમની વાણીમાં એવી અપૂર્વ મિડાશ હતી કે કેન્દ્રું હું વર્ષન કરી શકતી નથી. તે તો હંસ કેવા હતા અને આ કુદ્દી તાં કંડ કેવો છે. હે પિતાજી! ત્યાર પછી અમે આનંદ કરતા બેડા હતા તેવામાં ત્યાં હિસિદ્ધ મંગી આંદ્યો. તેણે મારા પતિને કાંઈક સમસ્યા કરી. એરથે મારા પતિ હિંદ્યા. હું પાછળા ચાલી, એરથે હું હિસકે મને દોડી રાળી. હું પણ સમસનું સ્થાન અને અથ્યમ રાની એરથે શરમાદને પાણી વળી. તે વળને મારા પતિ ગયા તે ગયા, મેં બધુ વાર રાદ કેન્દ્ર પણ પાછા આંદ્યા નહીં. તેવામાં આ કુદ્દી મારો પતિ થતો આંદ્યો અને મને પ્રીતિ બાતાવવા લાગ્યો. હું તેનાથી હુર કર્યાને હલી રહી અને એનું વચ્ચન મેં માનનું નહીં. કારણું હું તરતક તેને આદૃતિ તેમજ ચાલ અને શાખાદિવિંડે એણાળી ગઈ હતી. નયારે મેં તેનું કાંઈ માનનું નહીં ત્યારે ત્યાં આવેદી તેની ધાવમાતાએ પોકાર કર્યો અને તે બધાંચે ભળીને સંકેત કરી રહ્યો પ્રમાણે મને વિષકન્યા હરાલી. હે તાત! આ બધું હું અક્ષરથઃ સત્ય કહું છું. આ કુદ્દી કોઈ ધીજુ ઝીનો પતિ હશે, મારો પતિ તો આભાધળી છે. સિંહલ રાજાએ આપને લ્લાળંયા છે અને વગર વાડે મારી ઉપર મોટો જુલમ શુન્નો છે. હે પિતાજી! મારી કંડેલી આ હડીકત જે અધ્યાત્મને અત્ય લાગે તો સ્વીકારો, નહીં તો પછી આપને ચોગ્ય લાગે તેમ હડો. કારણું સુવીનું ભાગ તો પિતાને આધીન છે. પુત્ર ને સુવીનાં બહુ કેર છે. સુવી તો 'દીકરીને ગય' હોઈ ત્યાં લય. એ કંડેલત પ્રમાણે આપ કે પ્રમાણે ફરમાવો તે પ્રમાણે કંડોને બધાંચે રેલી છે. પુત્ર તેવો પ્રતિબંધમાં નથી. પરંતુ આપે તે હૂસેલા વચ્ચન ઉપર પ્રતિત કરવા લાયક નથી. પછી આપ મારા પર કોષ કરશો. તો મારો તો કાંઈ ડિપાદ નથી. મારે કંદોડ હરવાનું કોણું સ્થાન નથી, પણ કંદોડ કે કંદું તે

लिंगारीने कहुँ शेष्य हे के लेथी आपनो यश वधे अने याहु धर्मात्मा न थाय. आर्थी वधारे हुवे भारे कांध कडेवानुं नथी.”

प्रेमलालचंद्री आ प्रमाणे इही रही एटले मुख्यमुद्दि भंत्रीचे राज प्रवै ठवुं के—“हे श्वामी! राजपुत्रीनी हडीकत बाबी भने तो साची लागे हे. आ डाढी तो तेनो वर नथी ए निश्चय हे. भाटे हुवे आप प्रेमलालने आपणे त्यां राणो अने आजानगरीचे शोध करवा माथस मेठालो. त्यां अंदराज छे? अने ते परखी गधेल हे के शी रीते हे? आ वातानी तजवीज करवतां खरी हडी. कत ज्ञेत्रमां आवशे अने प्रभु कर्शे तो भधां सारां वालां थशे. हुवे आ पुत्रीने हळवी ते तो धर्तिक नथी, तेमके पछी सत्य ज्ञेत्रमां आवे तो पखु नकासु हे भाटे छाव एनी शिक्षा मुक्तवी रभावो.”

राज बोध्ये के—“भने पखु पुत्रीनी वात सांखातां कांधक तंकट थयुं हेय एम आस थाय हे, तो हुमधा एने तमारे त्यां राणो. आपणे पाडी तजवीज करशुं एटले सत्य हशे ते तरी आवशे.”

भंत्रीचे राजतुं वचन क्षुव क्षुं अने राजपुत्रीने पोलाने त्यां लढी गधे. वेने हैव राखे तेनो वांडो लाण करवाने कुएँ समर्थ नथी. भंत्रीचे राजपुत्रीने येसाही जमाईते शांत करी. पडी क्षुं के—“तुं लगारे विता करीश नही, हुवे अशुभ पण गर्ह हे; हुं प्रयास करीने तारा पतिने मेणानी आपीश, वणी तारा पिता पखु काले तारा पर प्रसन्न थशे. ते तरङ्गनी विंता पखु करीश नही.” आ प्रमाणे धीरज आपवाची राजपुत्री भंत्रीने त्यां शांत थटने रही.

साध्या समर्थ सूर्य अस्त थयो, साध्या झीकी, ते अवज्ञरे हस्तरोजना नियम प्रमाणे राज राजसभा लरीने ऐडो. भंत्री पखु हाजर थयो. पछी अन्व सर ज्ञेत्र सभा समक्ष उला थडीने तेणे भक्तव्यज्ञ राजने असज करी के—“हे श्वामी! आपणे वे चार स्थितीने सिंहदर्पुरी मेकड्या हता तेने तेलवीने पुणे. तेमणे सिंहदर्प राजना पुनरे ज्ञेत्रल हशे. तेचो वे वात खरी हशे ते कळेश. झाथमां रहेवा कंडक्षुने जेवा भाटे आदर्शनी शी जळ छे?”

राजने ए युक्ति भसंद आवी एटले क्षुं के—“खरी वात हे, तेएने ज्ञेत्र येलावी अंगावो, तेनाथी आपलुने साची हडीकतनी अभर पडी शक्षे.” राजने हुक्म थतांक भंत्रीचे ते चारेने येलावी भंगाव्या. तेचो पखु तरतज्ञ अज्ञर थया एटले राजचे तेमने क्षुं के—“अदे स्थिती! तमे सिंहदर्पुरी राजपुत्रीना विवाह जेणदवा गया हता, तो त्यां वर्धने वर्दने ज्ञेवा हसी के तेंव? वे वात खरी हेय तेज कडेजे, किंचित् पखु गासत्य न कडेशे. अने असज्ञ राजुं रहेवे नही. तेमके ते महा पाप हे.”

राजना आवा हगाणु भरेता वयनो सांखणी यारे जलुआये परस्पर संज्ञा
ठीरे एक विचार करी दीयो. पटी रेमांधी एक जखु ऐव्यो—“ हे स्वामी !
हुं तो मारो होए के छे ते आपनी पासे प्रगट कड़ुं छुं. मैं तमाङुं निमक
गधुं छे ते हराम हरानो नथो. अमे जिंहलपुरीये गया अने त्यांना राज
पासे जई सगाई संधी वात कर्वा भांडी. अटसामां मारी वीजी उतारे विसरी
गयो हुतो ते भने सांखरी एटदे हुं ते लेवा गयो. पाठ्या आ नशु जधु नि-
वाह नड्डी करी. मैं कांडु कुंवरने लेयो नथी ने हुं विवाह मेणववामां पखु नथी.
हुं तो जेवुं छे तेवुं आपने कही दहि छुं. बाढी हुं याकरीचार थयो छुं; ते
मारो अपराध थयो छे.”

पहेला सचिवे आ प्रभाणे बनावटी वात कही पखु राज ते उपरथी समझ
गयो के—“ आ साक्षी लथंज्या छे, पखु तेबुं कुंवरने लेयो नथी ए तो चाक्स
छे.” हवे ज्ञेधये थीजे शुं छहे छे.

थीजे सचिव उत्तो थरने ऐव्यो के—“ हे स्वामी ! हुं आपनी पासे
साचे साचुं करीया, असत्य जरा पखु नदी कहुं. तेमके लर्प पखु दरमां सीधिज
याले छे, त्यां वांडा चाली शडतो नथी. एटदे हुं आपनी पासे जुहुं क्षेवनो
नथी. हे स्वामी ! विवाह हरवानी वात हर्वा जेडा ते वणने भने आगदा
हिवनना लोअननुं अलुर्ख यवाथी हुं देहयिंता भाटे गयो हो, त्यांधी पाठा
आवता सुधी मारी राह न जेतां बाईना नशु जधुआये विवाह मेणव्यो छे,
भने तो गलनीमां पखु गाइयो नथी. बाढी आपणु तो कुंवर काणो छे के जेदा
छे ? ते ज्ञेधये नथी. मारी तो कुंवरने लेवानी छोंश पखु भननी भनमांज
रही गध छे.”

राज थीजे सचिवना वयनो सांखणीने वधारे संशयमां पछ्या अने विचारुं
के—“ आ पखु साचुं योक्तो नथी परंतु आणु कुंवरने लेयो नथी ए तो चाक्स
छे.” पटी वीजने पुछ्युं एटदे ते ऐव्यो के—“ हे स्वामी ! मारी वात सांखणो.
हुं विवाह मेणव्यो ते वणत हाजर नहोतो एटदे मैं कुंवर काणो छे कुण्डो
छे के डेवो छे ते नेहुं के जाण्युं नथी. भने तो जिंहुण राजनो भाषेज री-
साईने ज्ञो रहेतो होतो तेने भनाववा मोहव्यो होतो. हुं तेने भनावीने आव्यो
तेवामां तो नशु जधुआये विवाह मेणवेदो होतो. हुं ए अवसर चूक्यो ते अरी
वात छे, ने ए भादो अपराध पखु थयो छे. परंतु हुं कुंवरने दीडा शिवाय
हीडातुं आपनी पासे णाहुं कहेतो नथी. तेमके हुं आपनी छरणयामां रहुं हुं
तेवी भाराथी ऐहुं तो भेदायज तेम ? वणी शीक धर तो काढखु पखु
आहे शीकी इक्कील के. एटदे हुं ते ऐहेहहुं हुं ते हहुं हुं.” यस वात ला-

૩૪

જોતિષ્પદ પ્રકાશ.

જણીને રાજયે જાપણું કે ‘આ ચણ બોટો છે, પરંતુ એહે કુંવરને જોગે નથી એ વાત ચોકસ છે.’

પછી રાજયે ચાચા સચિવને ઠણું કે—“હવે તમે ફોલો, તમારો વારો આવ્યો છે, પણ કે ફોલો તે સાચું ફોલે. જે ગુંડું કંડેરો તો પછી તેનો ગંડોલો જે લોગવારો પણ તેમાં ભારો વાંક ઢાઢરો નહીં, કેમકે હું તૃપ્તમાન થઈશ તો, પછી કોઈની શરમ રાખવાનો નથી. મને ચોણ્ય લાગશે તે શિક્ષા કરીશ. ભાઈ કે બોલો તે સાચું જ બોલજો.” રાજના આ પ્રમાણેના સાચું વચ્ચેનો સાંભળીને ચાચા સચિવે વિચાર્યું કે ‘હવે ગોટું ચાલવાતું નથી, ભાઈ સાચેસાચું જ કહી દેખું.’ તેણે ઠણું કે—“હે રાજન! હું આપને ખરેખરી વાત કણું કું તે સાંભળો. અમે સિંહણ રાજ પાસે રાજપુત્રનીના વિવાહ મેળવવા ગયા ત્યારે ત્યાં જઈને સિંહણરાજને વિવાહ માટે ઘણું ઠણું, છેવેટે હિંસક મંત્રીએ માંડ માંડ હા પાડી. પછી અમે ઠણું કે—કુંવરને દેખાયો. ત્યારે હિંસક કંડે કે—તે તો તેને મેલાળ ભલુવા ગયેલ છે. અમે કુંવરને જોગ ખાણ કર્યો, ત્યારે હિંસકે અમને ચારે જલ્દુને કોડ કોડ સૌન્યાંસાં આપ્યોને જોગવ્યા. એટલે અમે તમારા સેવક છતાં લાલચમાં લેવાઈ ગયા ને વિવાહ મેળવ્યો. આ પ્રમાણે અમે તમારાથી પ્રપંચ કર્યો. અમે કુંવર કેવો છે તે બીલકુલ જેચેલ નથી. અમે તો કુંડપટના ઘર હિંસક મંત્રીને જ જેચેલ છે. આ પ્રમાણે અમારી ખરેખરી હુંડીકિંત છે. હવે આપને કે ચોણ્ય લાગે તે કરો. અમારી મારી તકનીર આવી છે એ હું મારે મોડે રખુલ કરું કું કું.”

રાજને આની વાત સાચી લાગી એટલે રાજયે તેને ઠણું કે—“તે અરે-ખરી વાત કહી છે, મને તારો નિધાસ આવે છે.” પછી રાજના મનમાંથી પ્રેમ-કા ઉપરનો ડ્રેપ તહન નાશ પાડ્યો. જન્મારે પુષ્પયનો ડિફ્યુ થયો લ્યારે બધા સંચોગ અતુક્તા મળી ગયા. રાજયે ચારે જલ્દુને શુન્ડો માઝ કરીને છોડી દીધા. અને સુભુદ્વિને ઠણું કે—“હવે મને તમામ જિંહલ રાજતું કપટ ભાસે છે. પ્રેમવાનો બીલકુલ વાંક નથી. તેને પરલ્યુને ગયો તે પુર્ણ અન્ય છે એ ચોકસ થાય છે, આ કુંધીએ ફેંગટ મારી પુત્રીની વિઠંગના કર્ણ છે. હવે આપણે તેના અરા વરની (ચંદ્રરાજની) ગોધ કરવાની જરૂર છે.” મંત્રીએ ઠણું કે—“આપે ઠણું તે અરાગાર છે, પરંતુ જ્યાં સુધી ચંદ્રરાજનો પત્નો ન લાગે ત્યાં સુધી સિંહણ રાજને સહદુંદું અર્દી કંગને રાખવા ચોણ્ય છે.” રાજને તે વાત વ્યાજાંની લાગી એટલે તેણે જિંહણ રાજને સહદુંદું અમચા તેઓ. તે પણ અમવામાટે જોને લઈને આવ્યે. એટલે રાજયે સિંહણ રાજ, તેની રાણી, કુંધી પુત્ર, હિંસક મંત્રી ને કંપિક્ષા ધાર્યા-એ પાંચે જલ્દુને કરી થીન બધાને તેના

यद्यानना रास उपर्युक्ता नोडितो सार.

३३५

हेश तरह जवा सज आणी तेंमा पलू अथा स्वहेश तरह रवाने थंड गाया अने पांच जखा विभगापुरीमां डेहीना विधिमां रवा जता पोताना पापने पस्तावे ठरवा लाग्या.

हे यांदराननी शेखने माटे राज्यमे तजवीज करवा भांडी. एक जाई दानशाणा भंडावी अने लां बाहुर गामधी जे आवे तेने अश वस्त्राहि आपवा भाटे प्रेमकालक्ष्मीने तेनी अधिकारिष्या बनावी. राज्यमे सूचव्युं के—“जे डोळ परहेशी नवो आवे तेने तारे आभानगरीनी खगर पुछवी ने जे डोळ खगर आपे तो तारे भने खगर ठरवा.” त्यार्थी प्रेमकालक्ष्मी पितानी आज्ञा प्रमाणे दानशाणामां रहीने दान आपे छे अने नवा नवा परिक आवे तेने आलानगरीनुं वृत्तांत पुछे छे, परंतु डोळना तरह्यां तेनो पत्ता भग्ना शक्तो नयो.

हे डेवी दीते यांनुपतिना समाचार भोगे छे अने त्यार पक्षी तेने भेणववा भाटे शु प्रथत ठरवामां आवे छे हृत्याहि हृषीकेत हे डेवीना प्रकरणामां ज्ञेय्युं. हुमणा तो आ प्रकरणामां ठरव्य शु छे ? तेना विचार करीमे ने तेमां रहेको सार हृदयमां धारणु करीमे.

प्रकरणु १३ भानो सार.

आ प्रकरणामां मुख्य हृषीकेत प्रेमकालक्ष्मीने भावेथी क्लंक उतरे छे अने अरी वात प्रसिद्धिमां आवे छे एटकी छे. परंतु तेनी अंदर ईर्मनी विधितितुं अने तेना उद्यनी विचिनतातुं प्रकट दर्शन थाय छे. नुच्चे, प्रेमकाने अशुभनो उद्य तीव्र थेचा त्यारे तेनो प्राण्यु विनाश करवा सुधी विधि आवी पहोऱ्या अने तेवा अशुभनो उद्य संपूर्ण थेचा एरवे ते विधि बदवाणी. धीमे धीमे पाणी राजने प्रिय हुती तेवाज प्रिय थंड पडी अने ते संपूर्ण निरपसाधी छे एम सानना लक्ष्मां पशु उत्तर्या. वील तरह्यी जिंहव दाननो परिवार केभां हिंसक भंडी मुख्य सुनधारे छे, तेणु पोतानी प्रपांचआणु एवी जंडी के छेवट सुधी अरी हृषीकेतनी डोळने खगर पडवा न हीधी. यांदरानना काढी मुडी पोताना कुटी पुनरे दाखल करता सुधी पशु द्वाया. प्रेमकाने विषडन्या उरावी अने पोते केवा हुता तेवा चाचा रवा. परंतु ज्यारे पापने घडे पूरे लराण्या त्यारे ते अधी वात एठदम विसराण थंड गर्छ. अरी हृषीकेत चाचा सविवे अगट ठरी अने राजने तेच्चा अधा पूरे पूरा आपराधी छे एम आदी थंड. जेने परिणामे तेमने डेहाणातुं वेहवानो वापत आव्यो. नुच्चे पापनुं परिणाम डेवुं आवे छे. एठवार कहि पाणी बची जय, उक्केला भान अन्मान भासे परंतु तेवुं परिणाम तेने वधारे ज्ञाई सज्जामां पडवातुं ज्ञाने छे. पहुऱीवार ज्ञाई शिक्षामांशी ने

३५६

जीवनवान् प्रश्नाका.

बाची गयों ते मौरी शिक्षा लोगवावा भाटेह. केमडे जे फेड्वी वधतज तें
अहम् शिक्षा लोगनवानो वधत आव्यो छेत तो ते मौरुं पापन इत्त ने मौरी
शिक्षा न पामत. अहीं सिंहदल राज्याचे पशु विवाह मेणवती वधत ना पाई
छेत अथवा पुनर्ने परस्परवावाने लाई आव्या ते वधत ना पाई छेत तो आवी
शिक्षा लोगवावी न पडत; परंतु भाग्यमां डेढपानुं लोगवावानुं लगेलुं होय ते
केम झेरे? नज झेरे.

हुवे आपण्यु प्रत्युत प्रसंग उपर आवीचे. आ प्रदरखना आरंभमां प्रे-
मदा पोताना पितानी पासे खाची वात प्रकट ठरतां क्षेळे छे के “पुनीचे आवी
पोताना पति साथेना एकांत समयनी वात पिता के वडील पासे प्रकाशित
कर्त्तवी ते चोर्य नथी, परंतु अस्यारे यीजे उपाय नथी, केमडे ते विना आ-
पना भनमांथी केई दीते शब्द नीठो तेम नथी.” प्रेमदाचे क्षेळी वात आपण्यु
प्रथम पशु वाची गया थीचे तेथी हुवे आंदो झरीने लग्वावानी ज़दर नथी.
परंतु तेमांथी सार अख्यु ठरवानो ए छे के-विचक्षणु मालुम डोऱ्हेने लुका-
वामां सरणवा ठिंडता नथी. परी जे ते अज्ञानपण्याथी खरी वात न समजे
अने चेते नहीं तो खाते यीकु दीते प्रतिज्ञाना भांगमां न आवी पडवा भाटे अदी
वात कृपय प्रकाशित पशु ठरता नथी. आ विचक्षणु भनुयेनी चेडा आस
ध्यान आपवा लायड ने अनुकरणीय छे. चंद्रशक्तये समस्यामां प्रेमदाने समन्न-
व्युं पशु ते वसावर समझ नहीं. एटके येते सिंहदल राज नाथे घांघायेव
होताथी प्रगट खुवासो न क्यों. आणण चालतां प्रेमदा क्षेळे छे के-‘हुं मारा
पति डिंसडनी डेरेली संजाधी चाल्या त्यारे तेनी पाठण जती हुती पशु डिंसडे
आडा पडीने जवा न दीधी एटके हुं शरभाईने पाणी वणी.’ कुणवान खीतुं
कुपखुज लग्नां छे. ज्लेडे डोऱ्हे वधत तेथी ठिं पशु लोगवावुं पडे छे, आगवड
वेड्वी पडे छे, धारी अभिलापा पूर्वु यती नथी, परंतु तेवा ठारखुने लाईने
भर्यांठ ताहु हेवी ए कुणवावुनो धर्म नथी. भर्यांठा छेत्वानुं ठारखु धर्णी वधत
तो अशुवटी स्वतंत्रता लोगवावानी प्रणाल ठिंडतज छेय छे. आ जमानो ए
पाठणमां बहु आगण वधेदो छे अने तेथी भर्यांठा हितपरहिन बहुज धरती
नथ छे. ज्लेडे इत्तु पशु कुणवान खीं पुढ्य वधारे भर्यांठा जागावे छे अने तेज
खरी शीते तेना भुपखुरुप छे.

प्रेमदा ज्यारे पोतानी इक्कित क्षेळे छे लारे राज्यने आवी थवा भाटे सु-
गुदि प्रथान केडलाक सवाहों खुडी वातने ठड ठड छे. आते राज्यने एटकी तो आवी
थास के ‘आसां ठार्हक प्रथाच थधेदो छे’ राज्यना कर्ती अहीं क्षेळे छे के-
‘कारुं ठार्हक सुरो लालाक्षासारीं उलटी व्यावे के.’ राज ठारु पशु सु-

ત્રીને પોતાને ત્યાં ન રખતાં સુષુદ્ધિને ત્યાં રાણવા કહે છે. સુષુદ્ધિ તે ઇસમાનને માન આપી પોતાને ત્યાં તેને લઈ જય છે અને સારી દીતે હીલાસે આપી તેને શાંત કરે છે. પછી વિચાર કરતાં તેના મનમાં નવો તક પેદા થાય છે; એટલે તે રાજસભામાં જઈને રાજ પાસે પ્રકટ કરે છે.

દરરોજ સંધ્યાકાળે રાજસ્થાને કંચેરી લખવાનો રીવાજ પૂર્વે હતો, તે વાને તમામ અધિકારીઓએ હાજરી આપતા હતા. હેઠી પરદેશી નતા વેપારીઓ આવવા હતા. નવા નવા અનુભવની વાતો થતી હતી. અન્ય અન્ય દેશના પંડિતો પણ આવતા હતા. વિદ્યાવિતોહ પણ ચાલતો હતો. ડેટલીક વખત ગાનતાન પણ થતાં હતાં અને ડેટલીક ઇંધોના ઈન્સાર પણ તરત વાતકાળિક કરવામાં આવતા હતા. આ પ્રસંગ બુદ્ધિમાનોને ચારુર્ય મેળવવામાં બહુજ ઉપયોગી હતો. અને તેજ કારણુથી અતુરાધન મૂળ જે પાંચ કહેલા છે તેમાં રાજસભા અવેશ ગણું વેદો છે. હાલમાં તે પ્રવૃત્તિ ઘણે ભાગે બાધ પડી ગયા જેવી છે. કંઈ કોઈ જગ્યાએ તેવી પ્રવૃત્તિ હશે તો તે પણ મુંગી સલા હોય તેવો દેણાવ આપે છે, તેથી તેમાંથી અજ્ઞાત મળે તેવું દર્શિયોચર થતું નથી. હાલ તો રાજસભા પ્રવેશનું સ્થાન ન્યાયકારોએ અમુક અંશે દીધેલું છે અને તેમાં પણ અરી રીતે હાઈકારોન તે પંક્તિમાં સુકરા ચોયા છે.

માંદી વિવાહ મેળવવા ગણેવા ચારે નાચિયેને જોલાવીને પુછવાનું સૂચયે છે તે રાજને ધરિત લાગે છે. એટલે તરતજ તેઓને તેહાવવામાં આવે છે ને તે હાજર થાય છે. પરંતુ રાજના પુરેલા સરાદતા જવાબમાં પોતે લીધેલી દૃશ્વત છુપાવવા માટે પણ સચિવો બુદ્ધાં બુદ્ધાં બાનાં બતાવી પોતે વિવાહ મેળવતી વખત હાજર નહોની એમ જ્ઞાનું કહે છે. એક વાર ઇસજ ચુકનાર-અસત્ય માર્ગો ચાલનારને ત્યારપણી પોતાના બચાવ માટે ડેટલી વખત અસત્ય મેલદું પડે છે તે અહીં વષપું થાય છે. જેની નોકરી આપ છે, જેનો વિશ્વાસ ધરતો છે, કેનું નીમક ખાંચું છે તેની પ્રાણુથી વહાલી મુર્દીને પણ ખાડામાં નાખી હેઠાં એવા લાલચું ભાણુસે હસ્તા નથી. આધુનિક સમયમાં પણ કંચે વત કરનારા લાલચને વશ થઈને કસ્યાને હુંઘના ખાડામાં હોની હે છે અથવા વસ્તે લાડે માડકું વળગાડી ફિલ પોતાને સ્વાર્થ સાથી જય છે. અને તેની પર રાખેલા વિશ્વાસનો ધાત કરે છે. નાણ નાચિયેએ કહેલી હંદીકતજ તેઓ જ્ઞાનું બેદી છે એમ બાતાવે તેવી હતી. પરંતુ તેમાં રાજસુવને ન જેયાની બુદ્ધ અદો હનો એટલું રાજ આણ્ય કરી લે છે. પછી ચાચા નાચિયને પુછતી વખતે રાજ તેને પ્રથમથીજ વધારે જતાવે છે અને જ્ઞાનું મોકલો તો પોતે બધી સાધત શિક્ષા કરશે એમ કંઈને તેને બતાવે છે.

अट्टेते राजतेज अनी शक्तो नथो अने शिक्षानो लय तेन साचुं क्षेवा प्रदे
छे, अट्टेते साचेशाची हीकृष्ट राज पासे प्रकाशित करे छे, राजने के वल्लुं हलुं
ते तेना ज्वाणभांथी मणी लय छे अट्टेपधी तेजो अपराध तो ज्ञे के धण्डा
आदे हो छतां माव माझी मागवाचीज तेजो एडी हे छे.

हुवे राज शुं क्षेवुं ? तेना विचार करे छे, ते वर्खते मंत्री सलाह आपि
छे के-‘ हुवे आपणे यांह राजनो पत्तो मेणववो, पण त्यांसुधी आ प्रपञ्ची
मंत्राने हुरी थवा न हेवा; अने केह करी राजवी? आवी सलाह आपवामां
आकरा गुन्हामां ज्ञमीन उपर छेउवामां आवता नथी तेभां ने मुद्दे रहेको छे
तेज मुद्दे अमाचेको छे. अट्टेए अवा गुन्हेगार हुरा रहेवाथी ऐटा पुरावा उसा
करे छे अथवा साच्चा पुराव तोडी नापे छे. आ प्रपञ्ची मंत्रानां हिंसक मंत्री
अवो हुए स्वभाववाणी छे के वर्खते ते लाग आवे तो तेनी सामेना मुख्य साक्षी
यांहराजनोन विनाश करी नापे. आ अशुद्धीते लोडेने क्षणे राजवानी कुरुद्धि
मंत्री सलाह आपि छे, अने राजने गणे ते वात तस्तक उतारे छे.

पधी राज सिंहवराजने सप्तस्तिवार चोताने त्यां जमवानुं नेताङ्के क्षेव-
रावे छे. अट्टेते पलु वेवाईने त्यां जमवा अवानो लदावो लेवा अने कुट्टीवर
आसाने वेव जमवानो लदावो लेवा, सिंहवराजनी राजी वेवाईने मावा अने
हिंसक मंत्री माटो शीरचान मेणववा होंशे होंशे आवे छे. पलु त्यां जमवानुं
तो जमवाने उडाणे रहे छे अने आपी प्रपञ्ची मंत्राने केह कर्त्तवामां आवे
छे. ते साचे जल्लावी देवामां आवे छे के-‘ तमारे प्रपञ्च तमाम जहर थई
येहो छे तेथी हुवे यारा वर्सो पत्तो मणतां सुधी तमने अर्ही केह राज-
वामां आवनार छे. माटे तमारे हुवे निरांते अर्ही रहेवुं, तो वातनो उचाट के
उतावण कर्त्ती नहीं.’ आ हीकृष्ट सांखाणां सिंहवराजना ने हिंसक मंत्रीना
हाथ लापे पठे छे. सिंहवराज हिंसकनी सामे लेइने क्षेहे के के-‘ अदे हुए !
आ अधी तारी कर्त्ती विट्ठणनानुं इता अमारे भोगववुं पठे छे. ते अमने
अवणे रस्ते यडाव्या तेनुं आ परिष्याम आवव्युं छे. हुं तो प्रमर्थीन धारतो
होतो के आ संघ द्रावका पहेंचवानो नथी, अने पारझी युवीने इंहमां इसा-
ववी येव्य नथी, परंतु तारी बादसलाह पासे माझी धारणा बर आवी नहीं
अने हुं पलु तारा विचादभां सामेव थयो. तेथीन अत्यादे राज मरीने केही
थवुं पठयुं छे.’

हिंसक क्षेहे के के-‘ अमां मने काठ क्षेवालुं नथी, तीक्को तमारे परव्य-
वानो होतो ने राजपुत्री तमारे त्यां आववानी हती; अमां मने काठी अपूर्व
द्वाज सालानो नहीले.’ आपी अपी केहभां पठया पलु तेच्ये वड्ये तो

ચંદ્રશાળના રસ ઉપથી નીકળતો સાર.

૩૫

ઘણી વાતો યદી હુણે અને પરસ્પર ઘણી એવાંલા હેવાણું હુણે, પણ આપણે તે બધું લાખવાની કે સંભગવાની જરૂર નથી. આપણું તો આ હડીકિત પરથી સાર એ લેવાનો છે કે-' પાપ ડોઈ કણે પ્રગત થથા શિવાય રહેતું નથી. તમે ગમે તેટલું છુપું' પાપ કર્મ કરો પણ તે અસુક મુહે બણાડ આવેજ છે અને તેની થોળ્ય શિક્ષા આ ભવમાં કે પર લાવમાં પ્રાણી માત્રાને બોણતી જ પડે છે. માટે ડોઈ પણ જતનો છળા, પ્રપંચ, હગાઈ કે વિશ્વાસધાત કરતાં પાછું એસરવું. અને તેનાં કરતાં ઇણ નેવની જામે ખડાં કરી હેવાં, કે કે જેધને મન તેવાં પાપ કર્મથી પાછું વળે. સિંહશાળતું દૃષ્ટાંત એવે વખતે યાદ લાવવું કે જેથી પાપનો ખદ્દોં તો મળે જ છે એમ લક્ષ્યમાં આવે.'

આપરાધીને કાગણે રાજ્યા પછી હુણે ખરું કામ મૂળ પુરુષને શોધી કરું
વાતું ઉપરિથિત થય છે. તેના ઉપાય માટે રાજ મોદી દાનશાળા મંડબે છે
અને તેમાં આવતા દૂર દૂર દેશના માલ્યસેને પુછવાથી આબાધુણીનો ન ચંદ્રશાળનો
પત્તો મળશે એમ ધાર્તવામાં આવે છે. તે વખતે તાર કે રેવબે જેવાં જાથ્યના
હોય એમ જણાતું નથી કે જેની દ્વારા થોડા વખતમાં જણે પત્તો મેળાવી શકાય.

હુણે પ્રેમલાલચી દાનશાળામાં જેણી નવા નવા પથિકેને પુછે છે રે
કાળ વ્યતિકુમારે છે, પરંતુ જ્યારે પાંચ કારણો પૈછી કાળ કારણ પરિપક્ત થશે
લાદે ડોઈ પણ નિમિત્ત પામીને ચંદ્રશાળનો પત્તો મળશે. તે હડીકિત આપણે
હુણે પણીના પ્રકરણમાં વાંચશું. હમણા તો જીત્ય અતે તરે છે અને પાપનો
ખદ્દોં વહેદો કે મોડો જરૂર મળે છે એવાતું રહયું હુદયમાં કેરી રામીને
આ પ્રકરણના ઉદ્દેશને સંકાળ કરવાતું વાંચકોને સૂચાવી આ પ્રકરણ સમાપ્ત
કરવામાં આવે છે અને આગળ આવનારી સુખ પ્રાપ્તિની હડીકિત સંભગવાને
વાંચવાને ઉત્કંદિત રહેવાની પ્રેરણ કરવામાં આવે છે.

ચીનના એક વિદ્રોહનના ઉત્તમ વાક્યો.

તક હોય છે પણ કે લૂલ કરતો નથી તે શૂરો.

તક હોય છે પણ કે મગરૂર થતો નથી તે શૂરો.

તક હોય છે પણ કે ધીનને દાણી હેતો નથી તે શૂરો.

તક હોય છે પણ કે હલકાઈ કરતો નથી તે શૂરો.

તક હોય છે પણ કે કોઈ કરતો નથી તે શૂરો.

ધીનને કે જાણે છે તે હાંકા પરંતુ પોતાને કે જાણે છે તે જાણી.

ધીનને કે જીતે છે તે બળવાન પરંતુ પોતાને કે જીતે છે તે બણાનું.

કે જાણે એ તેજ ધનલાનું.

દાનશાળ, જરૂર કરો.

एक हृदयद्रावक संध्या.

(एक पदपत्र विवेचन.)

जीराराधि देशना एक सुप्रसिद्ध नगरमां संवत् १६५८हना वैशाख वद्ध शी. ज्ञे दिवसे जिन प्रवेश महोत्सव होते, महोत्सव प्रसंगे अनेक प्रकारनी धार्म-
धुमो थहि होती, नगर बड़ारना उद्याननी मध्यमां आवी रहेता नविन जिन-
प्रासादनी बड़ारना निशा चैत्रमां सुन्दर देवीओ उपर दम्भ जिनालयो घनाली
तेमां भड़ार ११ निमित मूर्तिओ पधरावतामां आवी होती, तेनी आगण विक्षिर्षु
मंडप नाम्ही तेमां अरेक ध्वज अताकाथो सुयोक्ति इमानो, अचनिका आहिनो
विस्तार करवामां आव्यो होतो, द्वार प्रवेशथी अंत सुधी आणा मंडपमां
अने मंडपनी आग्नु आग्नु अनेक प्रकारना दीपकाना साधनो हांडी, लुभर विगेरे
आपूर्वक रीते जोडवी देवामां आव्यां होतां, वच्ये वच्ये अने आग्नु आग्नु मोटा
आदिसाच्यो जोडवी मंडपनी शोलागां वृद्धि करवामां आवी होती, अनेक रीते
चित्ताकर्षक मंडपनी पथवाडे नवीन जिनवेत्य आवी रहेतुं होतुं, तेमां आ-
सन्नविपक्षी श्रीचीरपरम्तमानी शांत संभय मूर्तिनी दयापना उक्त दिवसे
करवामां आवी होती, आग्नी संध्यानो दिवस वृष्टिनोहोतो, ए वणते मंहिरना गर्भ
गुडमां अने बद्यार रंग मंडपमां थूर, शर्करा, युप्प विगेरे वस्तुओनी वृष्टि
करी संध्या समये मंहिरने गंव करवामां आवे छे अने त्यार पछी लक्तानो
चांडिरनी बड़ार येती शुभ स्तननोहोतो नाद ठरे छे, आ प्रकारतुं विधान
शाचनिहिन करवामां आवे छे, वृष्टिनो विधि थर्द गया पछी संध्या समय
पूर्व थयो ते प्रकंगे भड़ात्सव निमिते योदावेत उत्ताढ लोक्क गानारे
वे चार सुंदर स्तननोतुं गान कर्युं, त्यार पछी अध्यात्म वैश्ययना एक ए पठ
लकडायी, छेवडे धनाशी रागथी नीचेतुं पठ गंयुं अने त्यार पछी मंहिरनो
आद्य आग पयु खंध करवामां आव्यो, आके नगरना वे लोकेने दर्शन करवा
संध्या समय पछी आववातुं थयुं तेमधे आद्य मंडपमां दर्शन कर्तनेन संतोष
पामवानो होतो, सुंदर स्वरथो उत्ताढ गायडे वे गान कर्युं तेना स्वरो अतःप-
र्यंत धनमां रभी रहेता छे, गाननी पथवाडे कर्यात्र उपेवे वे छेवडेवा धनाशीनो
आद्याप हयों ते अति अद्भुत होतो, एना स्वरमां अति भीडाश होता उभ-
संत एना सर्व साजनी एटकी एकता होती के अशिक्षित श्रावाने पखु गानमां
कर्त उपतो होतो, अनां ए गायडे के छेवडुं धनाशी रागथी चिह्नानंदलुना
पठ्युं गान कर्युं ते एक तो श्रावानोने भरत गानावी हीया होता, ए पठता
ज्ञानाप्रस ज्ञान वर्षत सुधी धनमां वायता होता अने राने सुधी वर्षत पक्ष ए-

એક હૃત્યદાનક ચંદ્રા.

૩૪૭

આ પ્રસંગે વિચાર ઠર્યો. પહું નીચે પ્રમાણે હતું કે વાંચવાથીજ એમાં રહેલા ગંભીર આશયને ખ્યાલ આવશે.

ભૂદ્યો જમત કહુ એ અજાન, ભૂદ્યો જમત તો

આસ પ્રાપાલ સકલ તજ મૂર્ખાય, કર અનુભવ રસ પાન. ભૂદ્યો જમત તો ૧
આચ હૃતાંત ગણેશો એક દિન, હૃતિ સુગ વેમ અચાન;

હૃત્યણો તન ધનથી તું ન્યારો, વેમ પાડો તર પાન. ભૂદ્યો જમત તો ૨
માત તત તરણી સુત સેંતી, ગરજ ન સરત નિદાન;

ચિદાનંદ એ વચન હુમણો, ધર રાખો આરે કાન. ભૂદ્યો જમત તો ૩

ચિદાનંદનુ મહારાજના આ કાનમાં ધારણુ ઠરી રાખવા ચેણ્ય વચનપર
બહુ બહુ વિચાર આવ્યા અને ઘરેઅર કે લયથી એ પહેને ગાઈ તેના
ભાવપર વિચાર ઠરે છે તેને અનેક રીતે નિચારમાં ગસ્તાત ઠરી હે તેવી તેમાં
લાનના સ્વષ્ટ રીતે માદૂમ પડી આવે છે. સાહી ભાષામાં બહુદ્યા સામાન્ય પંક્તિ-
ના અધિકારીએ પણ સમજ શકે એવા એ પહોને અંતર આશય તે રચિયે
ઠરેલા વિચાર અનુસાર અને ત્યાર પછી તેને અનુસારે વિકલ્પર ઠરેલા વિચારો
પ્રમાણે આહી વિચારીએ.

ચિદાનંદનુ મહારાજ આ ચેતનને ઠે છે કે, હે પ્રાણી ! તું અભાસયા
માણસની પેઢે કયાં રખડો કરે છે ? જેમ અસુક દેશ કે શહેરમાં આપણે જદું
હોય પણ તેનો રસ્તો વલખતો ન હોઈએ તો રસ્તામાં ફાંઝાં મારવાં પડે છે તેમ
અનુભયા માણસની પેઢે હે ચેતન ! તું કયાં રખડ્યા કરે છે ? આદ્યા ડિપરન્થીજ
વિચાર થાય છે કે આપણે ભૂદ્યા ભભીએ છીએ એ વાત ણદી કે નહિ ? આપણે
સનારથી ડીને રાત સુચી અનેક કાર્યો ઠરીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ,
નિહાર ઠરીએ છીએ, વ્યાપાર ઠરીએ છીએ, ધન એકદું ઠરીએ છીએ, પહેરીએ છીએ,
ઓડીએ છીએ અને થીજાં અનેક અનેક કાર્યો આપો ડિનસ ઠરીએ છીએ, યંત્રની
માઝક એક મિનિટ પણ નવરા પડતા નથી, અનેક ધમાધમો ઠરીએ છીએ, એક
ધમાધમ જરા એધી થવા માંડે તો થીજુ થાર પ્રવૃત્તિ શરૂ ઠરી હઈએ છીએ.
પરંતુ એ ડોધ કામ કરતાં આપણે ભૂદ્યા પડયા છીએ, રસ્તો શોધતા હોઈએ
અને જરે નહિ ત્યારે ગમસાઈ જરા હોઈએ એવું ઠદ્દિ લાગતું નથી. આપણે તે
નણે સર્વ કામ એ આપણા પોતાના હોય અને આપણે એ કર્વ સાચે
તાદાતથ્ય ચંંબંધ હોય એવું ધરનેજ કરતા હોઈએ તેમ ક.ગ. છે. એમાંનું
હોઈએ કાર્ય કરતાં ગરાપજુને ઠદ્દિ એમ તો લાગતું નથી કે આપણી ડેરી
વરતુ જોવાઈ ગઈ છે અને તે શોધવાને આપણે પ્રયત્ન ઠરીએ છીએ, પણ તે
આપણું હશુ જરૂરી નથી. અથવા આપણે દર્શિત નગરે જરૂરી જાર્ગ જૂદ્યા

छींचे अने साचा रस्तानी शोधगां पड़या छींचे. ज्यारे आ प्रभाषे लागतुं नथी त्यारे अध्यात्मी चिह्नानंदलु माझाराज शुं कठे छे ए जाणुवानी प्रथा धूच्छा थतां पहनी विचारथा आणाग चकावी तो ‘आज पंपाण’ शण्डमांज तेनो ज्वाण प्राप्त थध गयो. आपणे के सर्वे कार्य फरीचे छोंचे अने के कार्य करवामां आपलुने एक क्षणुनी पशु कुरसंह भणती नथी ते तो सर्व आणपंपाण छे. दरेक कार्य करती वप्पते कांधक अंतिम साध्य हेतु ज्ञेन्ये एवो साधारण नियम छे. ‘प्रयोगन वगर मंद पशु प्रवृत्ति करतो नथी’ तेथी ज्ञे आपणा कार्यतुं कांध साध्य न होय तो आपणे तो मंद करतां पशु भूर्ण गणुहीचे. आ प्रभाषे हेतु आपणा सर्व सांसारिक कार्येतुं साध्य शुं छे ? ते विचारीचे तो ज्वाणे के एमां डोळ वातनो ढंग खडे होतो नथी. सवारथी सांज सुधी काम करी पैसा पेहा करनारने पूछशो ते पैसा भेणवीने शुं करशो तो ज्वाण हुसवा नेवो भणेशे, आणो हिस्स पढी रही बापनी पुंलु उपर मेज करनारने लुंहगीतुं साध्य पूछशो तो आवुं पीवुं अने अशाराम करवो एवेज ज्वाण आवशे. आवी रीते राज्यना अधिकारीने, करकुनने, ओप्रीसवाणाएने, वकीलने के डोळुने पूछशो तो प्रवृत्तिनो अंतिम हेतु शुं छे ते डोळ यथार्थ कडी शक्षे नहि. पैसा कमावा, छोळरायेने भोगे वास्ते आपी ज्यो, भावुं पीवुं, सगासंबंधीचेना व्यावहारिक वेध साचववा, दोणी थध पथारीने वश थवुं अने अंते भरणु आने त्यारे चाहया ज्वुं-आ प्रभाषे एक प्रकारनी कुच करवानी ग्राहकृत लुंहगी थध गर्ह छे अने तेमां आ लुन आणो मींची विचार धयों वगर चावेज ज्य छे. पैसानी अतुम धूच्छानो छेडा आवतो नथी, हमर प्राप्त थये लाखनी अने लाख भणे करेइनी धन्या वक्याज करे छे अने एवी रीते ढंगधडा वगरतुं लुन पूर्ण थध ज्य छे. पैइगणिक वस्तुनी प्राप्तिमां डोळपालु प्रकारने आनंद छेज नहि. तेनो न प्राप्त थध होय तां सुधीज वस्तुनी दिंत छे. आयी वस्तु प्राप्ति के धन प्राप्ति एतो अंतिम साध्य होध शेज नहि. त्यारे आ बांधी प्रवृत्ति शाने भाटे ? आ सर्व धमाधम डेने भाटे ? आ यंवत् गतितुं अंतिम लक्ष्य शुं ? कांधक वधारे विचार करो, कांधक वधारे निर्ज्ञय उपर आवाय तेम एनुं मनन करो, कांधक वधारे हीर्दीहर्दीपणे अवलोकन करो अने विचारो के आपणे के धमाल कडी भूडी. छे तेनो कांध हेतु, कांध साध्य, कांध प्राप्तन्य के प्राप्त्य बिंदु छे के आवी असंबद्ध चर्ची छे ? आ प्रभाषे विचार करतां करतां धन प्राप्तिने आणे बाहु विचार थया. मनमां एवी भावना थध के आ धनप्राप्ति आतर ने धमाधम कडी भूडी छे, ते तहन पैइगणिक छे, आंसारिक छे अते हेतु तथा अर्थ वगरती छे. ए लंबाधमां ‘तुष्णूऽहेऽ’

ન વિષયમાં આજ માસિકમાં ને વિચારો અગાઉ કથ્યો હતા તે તાત્ત્વ થયા અને ભાસ થયો કે ધનની પ્રવૃત્તિનો સાધ્ય કે અર્થ વગરની છે. ક્રિત્ત આતર પ્રવૃત્તિ કરવી ને પણ. તેટલે અંશે ત્યાળય છે, કરણ કે તે માનઠાયનો વિભાગ હોવાથી પૈદ્યગલિક છે અને નામ તો કોઈનું અમર રહેવાનું નથી અને રહું નથી. લારે પછી આ બાબી ધમાખમ શાને માટે ? કોને અર્થે ? એને અગે બહુ બહુ વિચાર થતાં છેનેટે ચિહ્નાંદળું મહારાજના 'આળ પંપાળ' શાખ ઉપર સ્થિતના થતાં મનમાં નિર્ણય થયો કે અરેખર વર્તમાન સર્વ પ્રવૃત્તિ આદી આળ પંપાળ છે; ચેનાનું અનાદિ કણાથી પૈદ્યગલિક વસ્તુઓપર પ્રેમ થયો છે તેનો એક વિભાગ છે અને સ્વતઃ વિભાગ દશા હોએ અધિયાત્રાત કરાવનાર છે.

આ પ્રમાણે વસ્તુ સ્થિતિ હોવાથી હેઠે આત્મિક અને પૈદ્યગલિક વસ્તુઓ વચ્ચેનો સંબંધ વિચારપથમાં આવનો ગયો. વિચારતાં એમ જણાયું કે આ જીવનનો જીવાલ અતિ વિકિટ છે, એનો નિર્જય કરવામાં અનેક વિદ્યાનો ગોથાં આઈ ગયા છે અને પુદ્ગળા આસક્તિને લીધે તેનું ત્યાળય સ્વરૂપ સમજાયા પછી પણ ધણા ભરા તેનો ત્યાગ કરી શક્યા નથી. તેટલામાટે અધ્યાત્મમજ્ઞાની મહારાજ કહે છે, કે હે ચેતન ! તું આમ અજાનીની માઝક ભૂલા પડીને કથાં રખજ્યા કરે છે ? તું જરા વિચાર તો કર અને તરા પેતાના માર્ગનું અવલોકન તો કર. તું સમજું થઈને આ પ્રમાણે અજાણ્યાની માઝક કથાં રખજ્યા કરે છે અને માર્ગભ્રષ્ટ પથિકની પેડે વિમાર્ગે કથાં ગમન કરે છે ? તેઓ આગળ કઢેછે કે આ સર્વ આળ પંપાળ છેડી હધને તું અનુભવ રસનું પાન કર અને પછી તું તેની મજા જે કે તને એમાં કેવો આનંદ પડે છે. તું કફાય કેટલીક ઉપર ઉપરથી ધર્મકિયા પણ કરતો હુદિયા, પણ તે સાધ્યવગરની અથવા પૈદ્યગલિક હુદો તેથી તને કાંઈ ખાસ લક્ષણ થયો નથી. તું તેટલા માટે અનુભવ કર અને વસ્તુ સ્વરૂપ એણણ. અનુભવ શું છે અને વસ્તુ સ્વરૂપ કેવી રીતે એણાખાય તે વિષે આપણે અહીં બહુ સંશોધમાં વિચાર કરીએ. આ સંબંધમાં વિસ્તારથી વિચાર આન્યનું કર્યો છે જે થોડા વગતમાં છપાઈને બહાર પડશે.

અનુભવ એ જ્ઞાનનું ચર્ચાયું છે. વસ્તુના વિચાર અને નિહિયાસનથી મનમાં ને વિશ્રાંતિ થાય તે રસાસ્તાવાને અનુભવ કરું છે. બનાનચીદાસે શી સમયસાર નાટકમાં અનુભવનું આ પ્રમાણે લક્ષણ આપ્યું છે. ધર્મી એવી વખત આપણે વસ્તુસરૂપ સમજાવનો થતાં કરતાં ઉપર ઉપરથી નેઈ જઈએ છીએ અને સમજુએ છીએ કે આપણું વસ્તુસરૂપનો એધ થયો; આ પ્રતિબાસ જ્ઞાન છે.

૧. આનંદભનનું પડેની ઉપેદ્યાતન લાભ જ્ઞાય છે. તે જુદી થાં રખતમાં અહાર ખરું રેમાં કો સંબંધની વિચારના રૂપેય છે.

એને સાડે હરિલદ્રસુરિ મહારાજ વિપ્યા પ્રતિમાસ જ્ઞાન એવો શાખ વાપરે છે. એવા ઉપર ઉપરના જ્ઞાનથી આસ લાભ થતો નથી. જ્યાં તુંથી વસ્તુસર્વપનો સમ્યગ જોધ ન થાય અને તે સમ્યગ જોધ થવા ઉપરાત તે બાળતમાં વાંચવાર ચર્વિણું ન થાય ત્યાં તુંથી એનો રૂપ જોધ થતો નથી અને ઉપરની ગ્રાણીઓ જોધ આત્મિકદેશિતિમાં મહદગાર બહુધા થતો નથી. ઘણી વખત એમ અને છે કે ઉપર ઉપરના વાંચ જોધવાળા માણસો વર્તનની બાળતમાં ચિથિક હોય છે તેનું કારણ એટલું જણાય છે કે તેઓનો જોધ સ્કુકમ નથી, ઉપર ઉપરનો છે અને તેથી તેઓને અનુભવ જ્ઞાન જરૂર પણ થયું નથી. આવી સ્થિતિ ઘણી વખત જેગામાં આવે છે તેથી વસ્તુસર્વપણ બારાણર કેવા પ્રકારનું છે તેનો વિચાર કરવાની જરૂર છે. આહી પ્રથમ અગત્યની બાળત આત્મિકવસ્તુ શું છે અને તેથી અન્ય વસ્તુ કઈ છે તે બહુ જારી રીને સમજવાની જરૂર છે. આત્મિક વસ્તુનો આદર કરી, અનાત્મિક વસ્તુઓનો લાગ કરવો એ બાસ આવસ્થકીય બાળત છે અને તેઠાં મારે અનાત્મિક વસ્તુઓમાં ખાસ કરીને પૈદગિક વસ્તુઓની ર્ચના અને તેઓનો સંગંધ અને આત્મરંધ્ય સાથેના સંચેગના કારણો અને તેની સ્થિતિનો આસ વિચાર કરવાની જરૂર છે. એ અગત્યની બાળતનો વિચાર કરતાં કરતાં પુછગણ ર્ચનાનું અનિયતત્વ રૂપ્ય સમજર્થ જણો અને એ બાળતનો નિર્ણય થતાં તેને બાણ કરવાનું અને તેનાપર મમતર રાખવાનું મળ ડરી જાઓ અને એક વાળ પૈદગિક વસ્તુ ઉપર ગૃહિ એણી થઈ એવું એના પરિચિતમાં જે વિચાર છે તેનો નાશ થઈ જાઓ; એવું ડલતિકમમાં આ જુરની પ્રગતિ બહુ જારી રીને થઈ જાઓ અથવા થતી જાઓ. ઉચ્ચતિ માર્ગપર અદેશો ચૈતન અન્યાન્ય શ્રદ્ધા કરીને વસ્તુસર્વપણ ઉપર જેમ નેમ વિશેષ વિચાર કરતો જાય છે.. તેમ તેમ તેને સંસારસર્વપનો જોધ થતો જાય છે અને તેપર તે જેમ નેમ વધારે વિચાર કરે છે તેમ તેમ તેને વિષય પ્રતિમાસ જ્ઞાનને ગણવે તત્ત્વપરિણુત્તિમત્તુ જ્ઞાન થાય છે. આ જ્ઞાનની બુદ્ધ સ્થિતિમાં ચૈનનજી વસ્તુસર્વપણના જ્ઞાનપર વિશેષ વિચેન કરે છે, વિશેષ નિર્ણયો કરે છે અને એકને એક બાળના વાંચવાર વિચારસપથમાં કોણાકરે છે. આ અતિ આનંદધાર્યક ચર્વિતજ્ઞાન ફશાની સ્થિતિને અનુભવ કરેલામાં આવે છે. એ અનુભવજ્ઞાનની ફશામાં વસ્તુસર્વપણ પર વચાસ્પિત વિચાર થાય છે, અસત્કર્પનજ્ઞાનનો નાશ થાય છે અને ભાગ વિષમ કુર્તા બદ્ધ કર્ગનમાં આવી નાય છે. એક સાધારણ બાળતમાં પણ જે વિચાર કરી કાઢ કરવામાં આવે તો બહુ કાશ થાય છે અને આંતર પ્રત્યાંત્રે, બહુદુષ નાશ થાય છે તો પછી વસ્તુસર્વપણના જોધપર થોથ્ય તત્ત્વ નિર્ણય જુદી જીવની ચર્વિણું કરવામાં આવે ત્યારે પછી અતિ ઝુખ્ખા-આંતર હશા ભગ્નત

અંગ ઉક્કુલાંડ સંપા.

ઉઠણ

થાય એમાં ટાંડી આશર્વદી નેલું નથી. આટલા માટે અધ્યાત્મજ્ઞાનીચ્છાયે અને ચોગીયોએ અનુભવ જ્ઞાનની ગણું શીર્તિ ગાઈ છે અને તેને પ્રાપ્ત કરવા વાર્ષિકાર ભૂદાનૂરા શહેરે માં લક્ષ્મામણું ઠરી છે. એવા પ્રકારની લક્ષ્મામણું કરવાને આશય એજ છે કે આ પ્રાણી ઘણી ખરી વઃર ઉપર ઉપરના આલાદી લેવાઈ જઈ પોતાના નિશ્ચયેને અનિન્યુત માની ઘણી સુખલતાએ કરે છે અને પછી ક્યારે પોતાની ભૂલો થયેદી અથવા થતી નુંએ છે, ત્યારે એટલું મોડું થઈ ગણું હોય છે કે પોતે તે સુધારી શકતો નથી, સુધારી શકે એવી રિથતિમાં પોતાની જલને સુકુ-વાની તેનામાં કામના અથવા શક્તિ રહેતી નથી અને આવી હુંગળતાને લીધે તે અનિવાર્ય અધઃ પાત ખરી સંસાર સરહ્યોમાં અતિ નીચે ઉત્તરી જય છે. આ સ્થિતિ હું કરવા માટે અથવા તેને સારું પ્રથમથી ઉપાય ઠરી રાખવા માટે ઉભાતિકમાં ચાગળ વધી ગયેલા મહાત્મા પુરુષો આ જીવને અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરવા વાર્ષિકાર ઉપરદેશ આપે છે.

અહીં ચિદાનંદનું મહારાજ તેટલામણે લક્ષ્મામણું કરે છે કે સંસાર ચક્રમાં માર્ગબ્રાહ્ય સુસાદીની માફક લક્ષ્માને ખલે તું આપણું હોડી દઈ અનુભવ રસતું પાન કર એટલે પેંફુલિક સંબંધની સ્થિતિ અને તેનાં કારણો સમજી, વિચારી, ધ્યાનમાં લાવી તેવા સંબંધનો ત્યાગ કર, અને ઉપર ઉપરના ગોધથી અનુભૂતિ નહિ જતાં વસ્તુના આંતર હુંમાં પ્રવેશ કર, વેથી તારી આ લવયાના નકામા કેરો કેવી ન થતાં ટાંડી જરૂર થાય. આ લવની યાના સર્જા કરવાનું સાધન અનુભવ જ્ઞાનની પ્રાપ્તિ છે અને તેમાં કેટલે અંશો પ્રાણી પદાત પડે છે તેટલે અંશો તેની સંસાર યાના નિષ્ઠળ થાય છે. સંસાર યાના એ શફ્ફોનો અહીં વર્તમાન લવને અંગે ઉવ્દેશ કરીએ તો સ્પષ્ટ જણુશે કે આ લવયાનાને નિષ્ઠળ કરવાનાં લાવમાં એક વિશેષ કાવ પણ રહેદો છે અને તે એ છે કે આ લવમાં કરેલાં કર્મથી નિશેષ અધઃપાત થાય એવું કાર્ય અથવા એવાં કાર્યો થવાં ન જોઈએ, કારણું કે લવયાના તેથી નિષ્ઠળ થવા ઉપરાંત વધારે નીચે ઉત્તરનારી થઈ પડે છે. આટલા ઉપરથી અનુભવ જ્ઞાનની ઉપરોગીતા સ્પષ્ટ રીતે વ્યજ્ઞ થઈ હોય. તે લવયાનાને નિષ્ઠળ ન થવા હેવા ઉપરાંત વધારે નીચે ઉત્તરાના અતિ અધમ માર્ગથી બચાવી લઈ ચેતનાનુંને ઉભાત હશામાં લાવી મૂકી તેની સારી રીને પ્રગતિ કરાવે છે અને અંતિમ સાધ્ય સર્વી હુંખથી નિવૃત્તિ રૂપ સચિચાનંદ સ્વરૂપ પ્રાપ્તિના માર્ગપર લાવી મૂકી તેમાં ચેતનાનુંને સારી રીતે ચાગળ વધારે છે.

આ પ્રમાણે અનુભવ રસતું પાન કરવાની અઠર્વણ લક્ષ્મામણું કરવા હૈનું સાંત તે આખત જરા પણ સુલતાવી ન રણવાનું હોયી મહારાજ જખાવે છે. તેઓ

ज्ञाने छे के जंगलमां अति आनंदथी इस्ता मुगने-हरखने डोधपथु दिवसे
डोधपथु वर्षने नेम अचानक सिंह पट्ठी भारी नांगे छे तेवी रीते यमराज-
मरुत्थुदेव तने अर्हीथी उपाडी जै तारा शुवननो अंत लावशे अने ते वर्षते
वारे एकदा एकदम सर्वं संभोगनी वस्तुओ—प्रभी प्रिया, पुत्र, धन, धर, हाड,
हुवेकी विग्रहे तारी सर्वं सामग्री छोडीने चाल्या ज्ञवुं पडये. आ बाणत
तदृन चोक्कम छे, भरवुं ए निर्झयात्मक बाणत छे, निःभंडेह हडीकत छे, शंका
वगरनी वन छे, मेडा मेडा भाँधाता ज्वेवा राजन्मा, चक्रवर्तीया अने ठंड्रो
पथु वर्षत आवैत्यारे चाल्या गया छे, तेओ गमे तेटडुं फरे तोपथु एक क्षम्भु
आयुःस्थिति वधारी शक्ता नथी, अने ते प्रसंगे चक्रवर्तीनी छण्ड ऋद्धि के
करोडेथी गणुनो परिवार साथे ज्वो नथी. आवी निर्झयात्मक बाणत होवाथी
तारे ए संबंधमां आस जगत रहेवानी ज़रूर छे अने तेमां खसुझ ध्या-
नमां राणवा लायक बीना ए छे के धये वर्षते आ सिंह आवी तारी उपर
झंडंग मारये अने तने पट्ठी जै देहथी जिस करी नाणशे तेनी तने अणर नथी,
तने ते बाणतनी चावीश क्वाडनी आरे! एक गिनिटनी पथु नेटिस मणवानी
नथी, अने तारे ए अवस्था प्राम थवानी छे ए उपर ज्ञायुं तेम चोक्कम
बाणत छे, तेनी साथे अटडुं पथु चे क्षम्भु छे के ते वर्षते तारी पासे ने-के
वस्तुओ इयो, तासाताजामां ने वस्तुओ इयो, तारी भाकीदीनी ने वस्तुओ इयो
ते ते सर्वं अर्ही रही ज्वानी छे, तेमांतुं क्षांधपथु डोधपथु तारी साथे आवत्तुं
नथी, तुं कई जै शक्वानो नथी, तारे एकदा चाल्या ज्ञवुं पडये अने तने
डोहिनी साथे एक गिनिट वात क्वानो के लवामधु क्वानो अवकाश पथु
मणशे के नहि एम तने तारां शुवन मार्गपर अवसेकन करी पद्माताप क्व-
वानो वर्षत मणशे के नहि ते पथु अचोक्कम छे. आवी स्थिति घण्या अवको-
ठनथी निर्झित थहु छे, अत्यारे तो भरवुं शाख पथु तने क्वयो लागे छे, भरवु
संबंधी डोहि उच्चार करे तोपथु तने ते अपमंगण लागे छे, परंतु ए बाणतमां
तारी मेडी भूत चाय छे. तुं जाणे छे के स्थितिने मेडा चक्रवर्तीया अने
तीर्थ-करो पथु उड्कंवी शक्या नथी, के स्थितिने ग्रतिकार मेडा धन्वंतरीया
पथु करी शक्या नथी, के स्थितिना विचारने अने ते भाटेनी तैयारीने तुं अपमंगण सूचक
माने छे तेमां तुं भूत्वे छे, ए तारा संबंधमां अति ऐह क्वावनारी बाणत छे.
तारा ज्वानने भाटे महुं अशु उड्कवनारी हडीकत छे. भाटे तुं आ स्थिति संबंधी
धरणर विचार कर, चोक्कम निर्झय कर अने ध्यान नाभीने पैर्य निश्चय पर
तसंभंधमां आवी ल.

મરણું એ અતિ નિવ્યાતમક હૃદીન હોલાથી એનાથી હરી જ્વાની જરૂર નથી. એને અગે કે કે હૃદીન આસ થાય તે સમજુ તેના સંબંધમાં અસુદુ ધોરણું કરી દેવાની જરૂર છે કે એથી લુચનપ્રવાહ તે રેખાપર ચાદ્યો લય એને તને કોઈ પ્રકારની અગ્રણ ન થાય. ચેતન તો કંઈ મરણું પામનાર નથી, એની અજરામરતા શાસ્ત્રપ્રસ્તુત છે. શરીરનથી ચેતન લિખ થાય છે તે સ્થિતિને મરણું કહેવામાં આવે છે. કેટલાં મૂડ પ્રાણીએ સાંસારિક હૃદાખ્યથી તમ થઈ મરણું હશે છે, પણ સંસાર હૃદાખ્યથી વ્યાકુળ થયેલાને કૃષ્ણાનો આ માર્ગ નથી. અર્થ-ગંગાથ થઈ હોય ત્યારે તેના પર અલુવાથી જરા વળત સારું લાગે છે પણ તેવી રીતે અલુવાથી પરિણામે વધારે વધારે હૃદાખ્ય ઉત્પન્ન થાય છે, એનું ચોથ્ય નિવારણ અલુવામાં નથો, પરંતુ થયેલ વ્યાધિને મટાડવાના ઉપાય શોધવામાં છે; તેવીજ રીતે સંસાર હૃદાખ્ય અરેખારી તપત લાગતી હોય તો તેનો ઉપાય હૃદાખ્યથી હરી મરણું શરીર માંગવામાં નથી, પરંતુ તેવી સ્થિતિ ફરી વળત પ્રાસ થાય નહિ એવા ઉપાય શોધવામાં છે. આ પ્રમાણે વસ્તુસ્થિતિહોલાથી હૃદાખ્યાના ઉપાય તરીકે કંઈ મરણુને હંચાલું નહિ, તેમજ આપણે મરી જવું છે એવા વિચારથી હરી પણ જવું નહિ. તેવી રીતે કૃષ્ણાથી કોઈ પણ પ્રકારનો લાલ નથી, તેરી મરણું જરાપણ હર જતું નથી અથવા અસ્તકતું નથી: પરંતુ મરણું મારે સર્વાંત્ત્યાર રહેવું. કોઈ સાથે સાથે વેર વિરોધ રાણવો નહિ: કોઈ બાળતમાં ઐહ થઈ ગયો હોય તો તેને મારે કથા યાચના હરી સર્વ જીવો જીવેનો વેર વિરોધ અમાદી કોઈ પણ વળતે મરણું આવે તો તેનાથી જરાપણ હરી વગર તેને ભાગવા મારે તૈયાર રહેવું. જેનું લુચન પવિત્ર છે તેને મરણના વિચારમાં કે મરણું તમયે કોઈ પણ પ્રકારનું હૃદાખ્ય થતું નથી. જેનું લુચન વિપમ છે તેને અહીં પણ ધમાધમ છે એને પરલબ્ધવામાં પણ તેજ સ્થિતિ છે: લુચનપ્રવાહ અતિ વિશુદ્ધ હોય, સાધ્ય સુસ્પષ્ટ હોય, તેને પ્રાસ કરવાના માર્ગ-પર પ્રવૃત્તિ હોય, તેમાં આવતા પ્રત્યવાચી હર કરવાનો પ્રયત્ન હોય તેવા લુચનવાળાને મરણુના વિચારમાં હૃદાખ્ય નથી, શોક નથી, ઐહ નથી. આથી લુચનને વિશુદ્ધ હરી નાખવાની બાદુ જરૂર છે. વિચારનું કે આ લવમાં ધર્મારાધનમાટે ને સગવડો મળી છે, કે જેગવાએઓ પ્રાસ થઈ છે તે વારંવાર મળતી નથી, એને એનો લાલ લેવામાં કે ન આવે તો તેના જેવી તક એવાથી ભીંગ વિશેષ ભૂલ નથી, અનેક લખાતર ગયા પછી વિશિષ્ટ પુષ્પોદદ્યે મનુષ્ય લવ એને તેમાં ધર્મારાધન મારે જેઈતી અનેક અસુકૂળતા પ્રાસ થાય છે. તેરી તેવી અનુકૂળતા પ્રાસ થાય પછી સાધ્યનું આધન ધરાબદર હરી લઈ લુચન ઉલ્કાન્તિમાં સારી રીતે વધારે ફર્જો જોઈએ. તેમ કરવામાં જરાં પણ પણાવ પડવું ન જોઈએ.

આવા પ્રકારની વસ્તુસ્થિતિ જોઈનેજ ચિહ્નાનંદળું મહારાજ ગાઈ ગયા છે કે એક દિવસ કરું કૃતાન્ત આવીને તેને અચાનક ગળેથી પછીશે અને તારી વસ્તુઓ છોડી ફૈને તારે ચાદ્રા જરું પડ્યો. જેમ પાડેલ ખાંડું વૃક્ષપરથી ખરી પડે છે તેમ તું જીવનવ્યક્ષથી ખરી પરીશ. આ પ્રમાણે મરણ ગમે ત્યારે વહેલું ખોડું જરૂર આવનાર છે એ વાત નિર્ણયાત્મક હોવાથી આ જીવનયાત્રા સફળ થાય તો જ વ્યાજળી ગણ્યાય, અનેક પ્રકારની ડિસમ જોગવાઈથી ભરપૂર મનુષ્ય જીવન નકારાનું ચાદ્રું જાય તો ઘણું જોડું થયું ગણ્યાય. એ જીવન સફળ કરવા માટે જીવનનું લક્ષ્યસ્થાપન શું છે તે નિર્ણય કરવો જોઈએ અને એને પ્રાપ્ત કરવાનાં સાધનો એઠાડાં કરવાં જોઈએ અને સાધનો મળ્યા પરી તેની પછીનાં પૂરતા પ્રયાસથી મંજૂયા રહેવું જોઈએ. લારે આ જીવનનું સાધ્ય શું છે ? તે વિચારાયે. ‘અજાન’ માણીએને તો આવા પીવાની વસ્તુઓ મેળવી, ધન સંચય કરવો, પુત્ર સુત્રાદિ પરિવાર વધારવો અને સાચી જોતી રીતે પોતાના નાના વર્ઝનમાં પોતાની માન પ્રતિષ્ઠા વધારવી એમાં જીવનનું સાધ્ય હેઠ છે. આપણે ઉપર જોઈ ગયા છીએ કે એ પેદગલિક વસ્તુઓ સગરનેહિએ પરિવાર અને કીર્તિ સર્વ કષ્યુસ્થાયી છે અને એવા પ્રકારનું સાધ્ય કરનારે-તેની ખાતર જીવન અવાહને નકારો વહીવી હેનારને ચિહ્નાનંદળું મહારાજ ‘અજાણ’ ની સંસારી વાત્તવિક રીતે એલાવે છે, આવા સાધ્યની શોધમાં ઇસનારને ભૂલો પરી જમનારની સાથે તેમણે બહુ ચોન્ય રીતે સરળાવેલ છે અને એવા સાધ્યને ‘અજાણ-પાળ’ તરીકે બહુ રૂપ રીતે તેઓએ વ્યપદેશેલ છે. ત્યારે આપણું સાધ્ય શું હોલું જોઈએ ? આ વિચારણામાં એટલું તો સૂપ્ત જાણાઈ આવે છે કે પ્રાણી ગમે તે પ્રકારે સુઅ મેળવવા પ્રયત્ન કરેલે, એ ધન ધન્યાદિ મેળવવા વડે અથવા અજ વધ.રવા વડે રથ્યું સુઅ મેળવવા ઈચ્છા રાગે છે, પણ એને વાત્તવિક સુઅનો અચાલ નહોવાથી કષિષ્ઠ સુઅ અને તે પણ માત્ર તેની માન્યતામાં રહેલા સુઅની શોધમાં અને તેની પ્રાપ્તિમાં આનંદ માને છે અને તેને પરિણામે થાય છે એમ કે જારી રેતે અપ્રાસ વિશેષ પ્રાસ થાય છે ત્યારે તેને સુઅ થવાને બદ્દે હપાદ્ય થાય છે. છતાં એથી વિશિષ્ટ સુઅ હોએ શકે છે એવો પણ તેને ઘાવ ન હોવાથી એડા ધન સંચયથી, પુત્ર પરિવારથી કે રથ્યું માન પ્રતિષ્ઠાથી તે પોતાની જતને સુઅની સમજે છે અને ઉધા પાયા ઉપર મંદયતા વ્યવહારમાં બર્તનારા કોડે પણ તેને સુઅની માને છે, પરંતુ આ વ્યવહારથી સુઅની લાગતા માણુસોનાં અંતઃકરણું જઈને તપાસ્યા હોય તો ત્યાં કેવું અંધકારમય ધમાધમતું જીવરૂપ જાણ્ય છે તે અવલોકન કરવા લાગક ણાગત થઈ પડે. તેના મનમાં જરૂરે અતુલ છન્દાયો, તૃતી ઈચ્છાએને અંગે થયેલી ઉપાધિએ અને ગણભડ જોડા

એક હૃત્યગ્રંથ સંપૂર્ણ.

૩૬૮

વળતાં દેખાશે. દેશી રાજ્યના મોટા અધિકારી કે સુંણઈના શેડીઆચોના બહિર્વેભવયી આડર્ધિત થવાને બદલે ડોઈપણ રીતે એક વખતને તેચોના માનસિક રાજ્યમાં અવેશ કરવાનો પ્રયત્ન કરવા ચોણ્ય છે અને તેમ થણાં વિશેષ જ્ઞાન અથવા ઉપરેશ વગર એકદમ પ્રતિત થશે કે એ સ્થિતિ ડોઈપણ પ્રકારે ઈલ્લાવા ચોણ્ય નથી. પોતાની સ્થિતિ જાળવી રાખના કોઈ કોઈ અથવા પંક્તિના આણ્ણીઓ અસત્કાર્યની પરંપરા કરવા ઉબક્ત થાય છે તે વાતને આપણે બાળુ ઉપર જાળીએ તોપણ એવા વેદ્વભાંજ એક એવા પ્રકારનો ઉચાટ છે કે તેથી મનની સ્થિતા કર્ફ પ્રાપ્ત થતી નથી અને જ્યાં સુધી સ્થિરતા પ્રાપ્ત ન થાય ત્યાંસુધી ડોઈપણ પ્રકારનું સુખ જોઈ શકે અથવા મળી શકે એ વ્યવહાર દૃષ્ટિથી પણ ન બની શકે તેવું છે.

લાદે વ્યવહારથી સુખી મનતાં સુદ્ધેનું સુખ તો વ્યવહાર ધોરણથી પણ સુખ હોય એમ લાગતું નથી, માત્ર અતિ સુધાતુર માણસ જેમ યાણી પીને ‘હોઈબા હોઈયા’ કરે તેના કેવું તે છે, એમાં વાસ્તવિક સુખ છે નહિ એ વંદારે સ્પષ્ટ વિચાર કરતાં જણાશે, પણ એ વિચાર કરતાં વ્યવહાર ધોરણથી જરા જીવું ધોરણ રાખવું પડશે. જે સુખની પછ્યાડે હુંઘ હોય તેને સમજું માણસ સુખ કહે નહિ અને વ્યવહાર સુખ હીર્ઘ કરાય ચાલતું નથી એ પ્રચેક અવદોક્ષન કરી જેનારના અનુભવનો વિષય છે, વળી એ સુખના પરિણામે કર્માપત્તિ પણ એવા પ્રકારની થાય છે કે અને અંગે અવિષ્યમાં અનેક યાતના સહન કરવી પડે છે. આ પ્રમાણે વસ્તુસ્થિતિ હોવાથી વસ્તુવિક સુખ એવું જોઈએ કે જે સુખ સ્વૃત્ત દૃષ્ટિથી નહિ પણ વાસ્તવિક દૃષ્ટિથી સુખ રૂપમ હોય, જે માનસિક અને આધ્યાત્મિક દૃષ્ટિથી સુખ આપનાર હોય, જે એક વખત પ્રાપ્ત થયા પછી નિરંતર બની રહે તેવું હોય, જે સુખની પછ્યાડે હુંઘ અથવા ચાલતાં સહન કરવાની ન હોય અને મહા ઉત્કૃષ્ટ દશા સૂચનન કરનાર હોય. આવા પ્રકારના સુખને સાધ્ય કર્યું હોય અને તેને પ્રાપ્ત કરવાનાં સાધનો ચોજવામાં લુચન મવાહ વાળી હીર્ઘ હોય તો લુચનયાત્રા સફરા થાય છે અને કદાચ આ લવમાં સંપૂર્ણ સાધનો એકડાં ન થાય અથવા સાધ્યપ્રાપ્તિ ન થાય તોપણ ઉત્કાન્તિકમાં એકવાર ચેતનને ભર્યી હીર્ઘ હોય તોપણી કર્મેકર્મે લનાનતરમાં પણ તે શુલ્ષ મર્ગપર આવી જઈ સાધનો સંપૂર્ણ કરે છે અને અનેક પ્રયત્નો કરી, પોતાના આત્મવીર્યની સંકુરણા કરી, મુડ્ધાર્થ કરી જાણ્યને પ્રાપ્ત કરે છે અને પ્રાપ્તે અવિચાર સુખ પ્રાપ્ત કરે છે. આવા પ્રારંતું સુખ નિવૃત્તિ-મોદ્દામાં છે અને તેને પ્ર.મ કરવા પ્રયાસ કરવો એમાં ભવયાત્રાની સફરાતા છે. જેઓ અજાણ્ણની પેટે માર્ગ બ્રષ્ટ થઈ જાંસાર શોરીમાં લૂલા પડી જાય કરે છે તેનાથી આ હીર્ઘ સુખપ્રયાન જર્બદાઃ દુર રહે છે

અને તેને તેનો ઘ્યાલ પણ આવતો નથી, તેને પ્રાપ્ત કરવા લાવના પણ થતી નથી અને તે ચેતાની નિરુપ અધ્યમાવરસ્યા હુર કરવાનો તેને વિચાર પણ થતો નથી. એવા પ્રાણીઓની તો ચંસારમાં આસક્ત રહી આડ અવળા લમ્બા કરે છે અને અનેક પ્રકારની ઉપાધિઓથી વ્યાસ થઈ જારે થતા નથી છે. એવા પ્રાણીઓનાં મન જ્ઞાયાં હોય તો મોટો જોહ થાય, એવા પ્રાણીઓની પ્રવૃત્તિ જોઈ હોય તો અનેક વિચારો આવે, એવા પ્રાણીઓના વિચારો બરાળર સાંભળ્યા હોય તો અનેક પ્રકારે વ્યાફુળતા આવે. આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારની મળ નથી, એક પણ પ્રકારનો આનંદ નથી, કોઈ પણ પ્રકારનું સુખ નથી, યોગીજીને તેટલા માટેજ કરે છે કે એક દિવસ આ સર્વ સંબંધ છોડી ચારણા જવાનું છે એ નિર્ભયાતમક બાળન છે મારે તારે હવે ભૂલા થઈને ભમલું નહિ. આવી સર્વ જ્ઞાનતું જ્ઞાન થતું તેને અનુભવ જ્ઞાન કલેવામાં આવે છે. જ્ઞાન થાય છે ત્યારે વસ્તુ સ્થિતિનો વાસ્તવિક વિચાર થાય છે અને તેવા વિચારને અંગે સાચા નિશ્ચયો થાય છે. આવી સ્થિતિ હોવાથી અનુભવ જ્ઞાનનું માહાત્મ્ય યોગમાં બહુ કંઠું છે. ઉપર ઉપરનો ઘ્યાલ ઘ્રણી વખત ઉપરેદ્દકેને અથવા શ્રોતાઓને બહુ સારો આવી જથું છે અને તેથી તેઓ વાત કરે તે સાંભળવા યોગ્ય લાગે છે, પરંતુ જ્યાં સુધી અનુભવ જ્ઞાન થતું નથી ત્યાં સુધી વાસ્તવિક બોધ કદમ્પિ પણ થતો નથી, ઉપર ઉપરના બોધથી તત્ત્વજ્ઞાન થતું નથી અને એવા બોધથી વિશિષ્ટ લાલ પણ થતો નથી; તેતું કારણ એ છે કે અનુભવ જ્ઞાન વગર સાધયની રૂપીતા થતી નથી અને અસુક સાધ્ય પ્રાપ્ત કરવા યોગ્ય છે એવા નિર્ભય યર્થાર્થ રીતે કદમ્પિ થતો નથી.

કદમ્પિ આ પ્રાણી એમ માનનો હોય કે મને મારું માણાય, ક્રી કે પુન સુખ આપયો અને તેથી તેઓ આતર પ્રયાસ કરી કાંઈ પ્રાપ્ત કરી રાખું અથવા તેઓના ઉપર આધાર રાખી હું સંસારમાં મસ્ત રહું: તેને રૂપ રીતે સમજવના મારે યોગી કંઈ કે તે તારી એક પણ પ્રકારની જરૂરીઆતની વસ્તુઓ તેઓ પાસેથી ભણે, તરું સાધ્ય સાધન તેઓથી થાય એમ તું માનિશ નહિ, તથી કોઈપણ ગજર તેઓથી સરવાની નથી એમ તું ચોક્કસ માનજે. સ્વાધ્યનો સ્નેહ સ્વાર્થમાંજ વિરામ પામે છે, સ્વાર્થનો સ્નેહ સ્વાર્થનો સંધરુ થતા દ્રેષ્ટમાં, આસ્રૂયામાં અપવા વિપરીત વૃત્તિમાં વિરામ પામે છે, એમાં જ્યાં બન્ને સ્વાર્થી એકાં થાય લાં સુખની આશા કેમ રહે ? બ્યન્દાડ રીતે પણ સગાઓનો સ્નેહ ક્ષયિક છે એમ જેયું છે. ધન આતર બાધાઓને લડાના જ્ઞાયાં છે અને તે પણ એવા લડે છે કે એક ધીન સથે પાણી પીવાનો બ્યન્દાર પણ રહેતો નથી, અને તે સર્વ ઝાંને મારે ? રીતે મારે ? સર્વ તેનો ઉત્તર અમને છે. પતિગ્ર

ઓનો રાગ કે સ્વી ઉપર પતિનો રાગ ડેવી અભિલાષાથી ડૃત્પદ થાય છે, તે અભિલાષા તુમ થવાના પ્રસંગ કે વય ન રહે લાડે શું રિયતિ થાય છે અને થાવન દરમ્યાન પણ અંદર કેટલા ગેઠા વળે છે તે સર્વને અનુભવમાં આવે તેવી ખાખત છે. એવીજ રીતે પિતામાતાના સનેહમાં પણ સ્વાર્થનો અંશ કેટલો રહેછે તે તેઓ તરફથી ક્રમાંગ અથવા હિન્કમાડ છેકરાયો તરફ વર્તણુકમાં રહેતા તરુણતથી રૂપી જ્ઞાનમાં આવે છે. આ તો બ્યવહાર વાત થઈ અને તેમાં કંદાચ અપવાદ પણ જ્ઞાનમાં આવે છે; પરંતુ 'જીવનતુ' સાધ્ય પરમ સુખ પ્રાપ્ત કરવાનું' આપણે ઉપર જરૂર ગયા તેને અગ્રો તો તેઓના તરફથી આપણુંને કોઈ પણ પ્રકારની સગવડ મળે એમ સમજવું' નહિ. આત્મોદ્ધાર કર્ત્વાની ઈચ્છાના માર્ગમાં તેઓ તરફથી અહુચોણ નાંખવામાં આવે છે, આત્મ સાધન કરવા ઈચ્છાનાર છોકરાનો તિરસ્કાર કરવામાં આવે છે અને તેને સમજાવી દ્રોષસત્ત્વાની સંસારમાં એચી લાવવાનો પ્રયત્ન સર્વત્ર જ્ઞાનમાં આવે છે. તેથી સાધ્ય પ્રાસિના માર્ગર્ગમનમાં તેઓ મદદગાર થઈ પછે એવું 'બનવું' ણહુધા-લગમગ સેંચે નવાણું રક્ત અશક્ય છે. આથી સાંસારિક સગારનેહુંએની ખાતર સાંસારયાના વધારવાનો નિર્ણય કરવો એ ભૂલભેદું છે અને બરાબર વિચાર કરતાં જણ્ણાશે કે આ છુટ ધનપ્રાપ્તિ વિગેરે જૈદ્રગળિક વસ્તુઓમાં લક્ષયાઈ જઈ તેની ખાતર લંદગી પૂરી કરવાના કારણમાં પોતાના સગારનેહુંએનો તરફની ફરજની વાતો કરે છે તે અસત્ય છે, સાચી વાત તો તેને ધન ઉપર અનાહિ કાળથી એવી મૂર્ખી લાગી છે, તેની પ્રાપ્તિ સાચવણી અને વિચારમાં તેને એટલો આનંદ આવે છે કે તે ધનની ખાતરજ ધન પછીએ મંજૂસા રહે છે. પુત્ર થયો ન હોય, થવાની આશા ન હોય તોપણું ધનની ખાતર એટલીજ તીવ્ર ઈચ્છાથી અને ણહુ જેર સાથે ગ્રીતિથી બાથ લીધી રેને ન અરચનારના દાઢ્યાં ધણીવખતે અનુભવ્યા છે, તેથી ધન ઉપરનો સનેહ પુત્રાહિ ખાતર છે એ વિચાર ભૂક ભરેલો છે. અનાહિ કાળથી પહેલી ટેવને લીધે આ પ્રાણી ધન વિગેરે સ્વૃક પદાર્થો ઉપર તેની ખાતરજ મંજૂસા રહે છે અને આગળ પાછળનો વિચાર દ્વારી વગર એમાં આસક્ત રહે છે, સાધ્ય અને હેતુના ઘાલ વગર તેને પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ કરે છે અને તેથી ધન પ્રાપ્ત થતાં તેમાં આનંદ માને છે અને તેની સાથે એવાનેરથી ગાંડ થાયે છે કે જાણું તેનો કાહિ વિચોગ જ થવાનો નથી. આ આણી માન્યતા ભૂક ભરેલી હેવાથી પરિણામ વિપરીત થાય એમાં જરાપણું આદર્થ્ય થતું નથો.

છેને તેટલા માટે યોગી મહારાજ કહે છે કે હે સનજનો ! તમે આ અમારું વચ્ચન બરાબર કાનમાં ધારણું કરી રહ્યો, એ વચ્ચન કાનમાં ધારણું કરી રહ્યો તમને સંસ્કરનો કરાગું જીવ આવણો અને કાંઈક યોગ્ય નિષ્ઠય તેને એરો

३५२

ज्ञेन्द्रियं प्रधारा.

थेरो. तमावै हमेशां याह राखतुं के उच्ची छट उपर मनुष्यवी संसार स्थनामां आ छुव तहन उंची भार्गी यावत्ये जाय छे, ते लुको परी यथेको छ, ते अत्यभार्गी उपर हम्बु आव्ही नथी, ते आणा पंपाणमां राये भाव्य छे, तेने एक दिवस जड़र भरी ज्वानुं छे अने मरती वापत तर्व वस्तुओ आदी रही ज्वानी छे, अने पुन, कल्प के भाषाप विगेहियी तेनी एक पशु गरज भरवानी नथी. आ साही भाषामां भताविदां अत्य स्वरुपो नेवा डानमां धारण्य करी तेनो भाव वार-वार विचारस्थे तेने बहु लाभ थेरो. आ नाना भरभा पद्धना प्रत्येक वाक्यमां बहु उम्हा वातो करी छे, ऐवा अत्युत्तम विचार इत्वा ए पशु एक प्रकारनो अनुभव छे अने ऐवा अनुभव प्राप्त थाय त्यारेज संसारधोधनो छुटे छे अने धर्दियजन्य विपथेतुं विस्तृत समग्रय छे. धनाशी रागमां गवाता आ यह पर वारंवार विचारणा इत्वा योग्य छे. मुख्यनोन्माये आवा भावो विचारी संसारनुं स्वरूप जड़र लक्षमां लेवा योग्य छे. ऐस्योने पेतानी उठानि इत्वानो-आत्मेन्द्रियमां प्रगति इत्वानो अने साध्य प्राप्त इत्वानो विचार छोय तेम्हे आवी अति अगत्यनी आत्मिक भाषणमां बहु सारी रीते विचार इत्वानी खास जड़र छे. ठारणु के आत्मिक वस्तुतुं ज्ञान हमेशां विचार इत्वाथी अने वस्तुना भूमा सुधी ज्वायाईज प्राप्त थाय छे. ज्यां सुर्खी उपर उपरनो विचार इत्वामां आवे छे लां सुधी ओध रप्त थोने नथी अने तत्त्वमोध वगरनी विचारणा विशुद्ध इगा आपनारी थती नथी. आत्मिक भाषणमां विचार इत्वो ए कुदरती रीते आत्मानुं कार्य छे, पशु तेने विभावमां रमण्य इत्वानी एन्टकी टेव परी गहि छे के शुभ विचार इत्ती वापते पशु ते स्थिर रहेनो नथी अने तेने डेणी नाम्हे छे. परी पेताना डार्यना साच्चा औया भवावो करी पापमंडथी उक्तो वधारे अस-दय छे. ऐस्योने तेरका माटे आत्मिक उन्नति इत्वानो विचार छोय तेम्हे सारी रीते विवेचना पूर्वक विचारणा इत्वानी खास जड़र छे. ऐवी सुन्दर विचारणामे परिणामे आत्मेन्द्रिय बहु सारी रीत थेरो. चिठानंदहु भद्रासनां आ अति भवुर वचनो डानमां धारण्य करी राखनानी आवश्यकता गतावी आ आत्मिक विचारणा हाल तो अब पूर्ण इत्वामां आवे छे.

अधीक्षा
भागभद्र वह ५.

कापडीया भोतीयांह गीरथरवाल.
(सोलीमीटर)

**जैन साक्षरता भुवना पत्र.
जैन साहित्य-संमेलन मार्गे हितयात.**

भृहदरथान जैनधर्म अकाशना विविधनि जग—

जैन साक्षरता किंवा साहित्यसेवीयोंने उद्देश्याने इष्यायेते नीचेनो पत्र
आपना पत्रमा प्रकट करवानी भृहदरथानी करतो.

साहित्य संमेलनतु निमित्त.

शासनप्रिय जैन साहित्य सेवकोंने आ भुवना पत्रकी अमो ज्ञानवानी
रत्न लक्ष्मि छीअंडे, अन्ते-सोनत (मारवाड) मुकुर्म गिरजाता ‘शास्त्र विशाख-
रह जैनाचार्य श्री विजयधर्मसूरि’ महाराजना हर्षनार्थ आगामी मार्च मासनी
१ दी तारीखे दोहर इर्मन जेटेणी तथा तेमनी साथे बीज जैन साहित्यप्रिय
साक्षरता अवे आववाना छे. ते प्रसंगने लाल लक्ष्मि अंडाङ जैन साहित्य संमे-
लन थाय अने विविध जैन साहित्य सेवीया अवे पवारी निषाध तथा वक्तु-
तदादा प्राप्तता अस्यासन्ता लाल आपे तो डीट, अम्बा विचार थवाथी अमारा
गामना कुरवाएँक उत्साही गंधुम्बाये अंड कैन-साहित्य संमेलन ता. १ दी
मार्च आववानो इरव कर्यो छे.

जैन-साहित्यसेवीयोंनु कर्तव्य.

परहपरनी अहायता विना आ गालीर ज्ञानमहारीवाणुं कर्तव्य सामूहि-
ण्डे अमे पार पारी न शक्तिए अ न्वालाविक छे, अटला मारे केहो जैन
साहित्यमां लरा पाणि रस लेता छेथ अने जैन साहित्यनी उद्धति मारे अम
लेता छेथ, तेयाने अमे आ पत्रकी विनानि करीअं छीअं के तेयाए अमने
बननी अहाय आपवानुं लक्ष्मां लेवु. जैन साक्षरतानी सहायता तथा तेयाना
अम उपरक आ साहित्य संमेलननी सद्गतानो आधार छे अम क्षेवामां अ-
निश्चयान्ति न गणाय.

साक्षरता अभियाये.

जैन-साहित्य संमेलनना धारेता उद्देश्यामां अमोने उपयोगी थहर पठे अवा
कुमनी अमो हरेक जैन साक्षर तस्त्री उज्जासा रामीअं छीअमे, अने तेथी
आशा रामीअं छीअं के जैन साक्षरता आ संमेलनना अधारलु मारे उपरन्तु
विचार चक्षावी, पसार करवा योग्य ठरावानी उपरेणा तथा निषयोना विषयोना
चुंटणी साथे प्रतिष्ठित लेअंडाना नामो भूत्यवानी तस्त्री लेशे.

उभरावयहलु सिंधी.

मंत्री, न्वागतकानिहु सुनिति.

गीते सूचना पत्र.

मान्यवर महाशय !

आ साथे मोक्षावेत शुद्धीपत्रमांथी क्लॅष्टिक्षय उपर एक निराध लभी ता. १५ भी देखुआदीनी अहं भोक्ता आपत्ता महेश्वानी करशो, अथवा तेथी अनिदीक्षा ज्ञनसाहित्यने कगता क्लॅष्टिक्षय उपर लभी मोक्षावेत तो पल ते समिति आभार अथे स्वीकारशो.

आप कथा विषय उपर निराध लभी मोक्षावेत ते जलही अखाववा तक्ती देशोऽु.

विषयोन्तुं लीस्ट.

- १ ज्ञन साहित्यनी उत्तमता.
- २ ज्ञन साहित्यमां गुञ्जशती लापाने भणेत्रुं रथान.
- ३ ज्ञन कथा साहित्य.
- ४ ज्ञन साहित्यमां धतिलाजनां भाषने.
- ५ प्राचीन शोधणेपेण्ये ज्ञन साहित्यपर पाडेला प्रकाश.
- ६ ज्ञन साहित्यमां अद्यात्मशास्त्रने भणेत्रुं रथान.
- ७ आज सुधीमां कट्ट कट्ट लापायेदारा ज्ञन साहित्यनी वृद्धि थई छे अने हुवे कट्ट कट्ट लापायेचा दारा ज्ञनसाहित्य लोडेपयोगी थट्ट शडे तेम छे ?
- ८ ज्ञन साहित्यमां पर्वर्थ ज्ञान.
- ९ ज्ञन साहित्यमां विविध विषयेने भणेत्रुं रथान.
- १० ज्ञन साहित्येनो अद्याज्ञो इवावो इरवानां भाषने.
- ११ प्राकृत ज्ञन साहित्य.

मंडी, स्वागत कान्दिष्ठी समिति.

हातमां तार दारा खवर भज्या छे के संभेदनतुं रथान आवनारनी अनुकूलाने भाटे अध्यपुर ठराववामां आ०युं छे.

तंडी.

જાહેર ખખર.

અમારી અલાની ઓષ્ઠોસમાં વેચાયુ ગગતા પુરતકોતું લીટ અમે છપા-
નીને જાહેર પાડેલ છે તે ઉપરંત નીચે જણ્યાદેશ પુરતકો પણ અમારી ઓષ્ઠો-
સમાંથી વેચાયુ ભરી શકશે.

૧	અમરકોષ શુભરાતી અર્થ સહિત (શાસ્કો)	૨-૦-૦
૨	આતમગોધ અંથનું ભાષાંતર	૨-૮-૦
૩	આષ્માંગળીકના રંગ રંગીત	૦-૨-૦
૪	આત્માજતિ	૦.૧૦.૦
૫	કુવલયગાળા ભાષાંતર (અત્યંત રસીક વાર્તા)	૦-૮-૦
૬	કેશરીયાળુના નકશા રંગીત કષણ સાથે.	૦-૬-૦
૭	કાળજાન. (શંખુનાથ વિરચિન)	૦-૬-૦
૮	ગોતમાયુચા બાળાપગોધ. કથાસહિત.	૦-૧૨.૦
૯	ગીરનાર માહાતમ્ય. (નાના કદના)	૧-૦-૦
૧૦	ગોમટસાર (કર્મ વિલાગ) હિંદી અર્થ યુક્ત.	૨-૦-૦
૧૧	ચંપાપુરીના નકશા. રંગીત. કષણ સાથે.	૦-૬-૦
૧૨	ચંહરાજનો રાસ અર્થ તથા રંગીન ચિત્રોસહિત. (મોટી ખુક)	૪-૦-૦
૧૩	ચોવીશી વીશી સંથકુ (શુભરાતી)	૧-૪-૦
૧૪	જૈની રાસમાળા. (શાંતિદાસ શેડનો તથા સત્ય નિઃય વિગેરે પન્થસેના રાસનો સંથક.)	૧-૦-૦
૧૫	જૈન પ્રમોધ (આચો. બન્ને વિલંગ સેળા)	૩-૦-૦
૧૬	જડપક્ષવલતા સંસ્કૃત (ડે. લા.)	૦-૪-૦
૧૭	તીર્થ ગાંડિ	૦-૨-૦
૧૮	તત્વવાતી ને લક્ષ્મી સરસવતિનો સંવાદ.	૦-૪-૦
૧૯	તૈવૈઘ્યગોષ્ઠિ સંસ્કૃત. (ડી. લા.)	૧-૮-૦
૨૦	દશાવૈકારિક સૂત્ર અર્થ યુક્ત	૧-૦-૦
૨૧	દેવસી રાઈ પ્રતિકમણુ સૂત્ર. શાંદાર્થ, ભાવાર્થ, વિધિ વિગેરે યુક્ત	૦-૫-૦
૨૨	દર્શન ચોવીશી. બહુ મોટી રંગીત	૦.૧૦.૦
૨૩	દાનકદ્વારા સંસ્કૃત (ડે. લા.)	૦-૮-૦
૨૪	ધનપાળ પંચાંશિકા. ટીકા, અર્થયુક્ત.	૦-૩-૦
૨૫	ધર્મપરીક્ષાનો રાસ.	૧-૮-૦
૨૬	ધર્મબિંદુ અંથનું ભાષાંતર ટાચુંસું (૧) = પાંડું સુંદું	૧-૪-૦
૨૭	નિત શિક્ષણુ (આસ વાંચના લાયક)	૦-૧૨-૦
૨૮	નારચંદ્ર. જૈન જ્યોતિષ અંથ ભાષાંતર સહિત.	૧-૪-૦
૨૯	નારીલાદું લાદું લાદું (ડી. લા.)	૧.૧૦.૦

३०	प्रभेयरत्नडॉप अंथ. मूणा.	संस्कृत.	०-४-०.
३१	पंचाशट अंथ टीका चुक्त.	"	२-८-०
३२	परिशिष्टपने.	(अमारूँ छपावेहुँ)	१-०-०
३३	पुरुषार्थ सिद्धि उपास. हिंदी अर्थयुक्त		२-०-०
३४	प्रकरण संख्या संस्कृत (आन्मानं द सभातुँ)		०-४-०
३५	पांडव चरित्र लाखांतर. गोदुः.		५-०-०
३६	पांडवचरित्र पद्मधार्थ संस्कृत (भद्रवधारीतुँ)		४-४-०
३७	पांतोश गोलना थोड़ा. (अमदावाहना)		०-१-०
३८	प्रद्युमनचरित्र शास्त्रांतर (शेतांभराचार्यतुँ)		०-१०-०
३९	प्रवृत्तनसार. हिंदी लाखांतर युक्त.		३-०-०
४०	थेग दृष्टि समुच्चय. संस्कृत (हे. ला.)		०-४-०
४१	थेग श्रीक्षेत्रसाही दृष्टिलु	"	०-६-०
४२	कर्म श्रीक्षेत्रसाही	"	०-६-०
४३	धर्म परीक्षा कथा संस्कृत	"	०-६-०
४४	यशोविजयलुतुँ लुवन.		०-२-०
४५	युगाहि हेशना. संस्कृत (ए. जतनी) हरेकना		१-८-०
४६	राम रास (कवि डेशराजलु फुत)		१-८-०
४७	बृंदावन्ति संस्कृत. (हे. ला.)		०-१०-०
४८	वेपारनी डगा. गुजराती		०-८-०
४९	शांतिनाथ चरित्र	" नाना	०-४-०
५०	श्रीयह डेवणीना रास. शास्त्री		२-०-०
५१	शांत सुधारस अंथ. टीका सहीत.		०-१२-०
५२	समक्षित डॉमुही लाखांतर.		०-८-०
५३	संवाद सुंदर. संस्कृत (ही. हः)		०-८-०
५४	समक्षित परीक्षा,	" "	०-६-०
५५	संस्कृत स्वयं चिक्षण.		१-०-०
५६	हडीझाईनी अंगन शलाक.ना ढाणीया.		०-२-०
५७	हुरिआ गाझी. नोवेल. गुजराती.		०-४-०
५८	ज्ञानसार आष्टक स्टीक.		०-१२-०

सुखना-प्रकरण रत्नाकर लाग पहेलो ३। पा-१॥ वालो भणतो नथी परंतु
मध्यम अगांक्षेना ३। १। नो अगे ३। लाग द ले, ३ ले अगता वथी लाग
लालाना ३। ५) छाना ते सोडा आकरतो छगावीने ३। ७) छ्यो ३। शी चिप-
पि लाल असूय चरित्र भाग्ना असूना एवं इ स्त्रीतो गीता लाली लाली।